https://archive.org/details/bk076/page/n0/mode/1up

1980 - Narayan Ramjino Pratidhwani (76)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

ॐ

શ્રી. નારણ રામજીનો પ્રતિધ્વની

શ્રી. નારણ રામજી સહ કુંપની આદિ સત્પંથ વિરૂદ્ધ લખનારાઓનાં સર્વ લેખો વિષેની છેવટની સૂચના.

(૧૯૮૯)

લેખક :
સ્વ. સૈયદ બાવા સાહેબ અહમદઅલી "ખાકી"
પ્રકાશક : મુ. પીરાણા

સત્પંથ સાહિત્ય સંબંધી સેવા કરનાર
પ્રકાશક : સૈયદ શમ્સુદીન બાવાસાહેબ ખાકી
મુ. પીરાણા (ડી. અમદાવાદ)

પ્રત ૧૦૦૦ આવૃત્તિ ૪ સંવત ૨૦૩૬

સને ૧૮૬૭ના ૨૫ મા એકટ મુજબ સર્વ હક સ્વાધિન રાખ્યા છે.

મુદ્રક : જયંતીલાલ મણીલાલ શાહ,
નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ.

"મુલ્ય" મત મેલી સત્યને સોધો.

realpatidar.com

https://archive.org/details/bk076/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 2, 3, 18, 19, 31.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format
References by: RealPatidar.com

https://archive.org/details/bk076/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.06 17:53:26 +05'30'

1980 - Narayan Ramjino Pratidhwani (76)

realpatidar.com

ૐ

શ્રી. નારણ રામજીનો પ્રતિધ્વની

શ્રી. નારણ રામજી સહ કુંપની આદિ સત્પંથ વિરૂદ્ધ લખનારાઓનાં સર્વ લેખો વિષેની છેવટની સૂચના.

લેખક :

સ્વ. સૈયદ બાવા સાહેબ અહમદઅલી "ખાકી

પ્રકાશક : મુ. પીરાણા

સત્પંથ સાહિત્ય સંબંધી સેવા કરનાર

પ્રકાશક : સૈયદ શમ્સુદ્દીન બાવાસાહેબ ખાકી
મુ. પીરાણા (ડી. અમદાવાદ)

પ્રત ૧૦૦૦ આવૃત્તિ ૪ સંવત ૨૦૩૬

સને ૧૮૬૭ના ૨૫ મા એકટ મુજબ સર્વ હક સ્વાધિન રાખ્યા છે.

મુદ્રક : જયંતીલાલ મણીલાલ શાહ,
નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ.

realpatidar.com

"મુલ્ય" મત મેલી સત્યને સોધો.

Most of the information is mentioned with the intention of discrediting the Great Shri Narayan Ramji Limbani & his team and to demean the good work done by them in uplifting ther fellow caste members.
Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk076/page/n3/mode/1up

ॐ

realpatidar.com

સૂચના

સત્પંથિયોની વિનંતિ—

આ મી. નારણ રામજી આદિ સર્વ લેખકોના લેખોનો સુચના રૂપે વળતો સાદ છે, છેવટનો આ કાંઈ જવાબ નથી. જવાબ લખાઈ તૈયાર થએલ છે, તે છપાવરાવવો હોય તો ખરચ માટેની જોગવાઈ કરશો.

શ્રી. નારણજી! તમો વિગેરેનો જવાબ શ્રી નિષ્કલંકી-ની દયાએ લખાએલ છે. ફક્ત સત્પંથિયોની ફરમાશે છપાશે. તમોને સત્પંથ સમજવું હોય? તો જ્યાં ..યોની મહાન સભા એકત્ર થવાની હોય ત્યાં જઈ શ્રદ્ધાળુ, ચારિત્રશાળી સત્પંથિથી સમજી લેવો! આમ ..ળાપા કરે, અને છાપખાનાઓમાં જ છાપાની કડાકૂટ કરે કાંઈ નહિ વળે, આવી મિથ્યા માથાફૂટ સજ્જન પુરૂષો પસંદ કરતા નથી. હમારે પણ થોડા નાસ્તિકોની ગલીચ ભાષાનાં લેખોનો, ના—ાલતાં ઉઘાડો કરવા જુના પુસ્તકો (પુરાણો)ની નોંધો પ્ર..ટ કરવી પડે છે. તેથી અન્ય મહાશયોએ એવો અનુમાન ન કરવો, કે અમારા છીદ્રો ઉઘાડે છે? મી. નારાયણ! તમારી યુક્તી એટલે ઉંધુચત્તુ સમજાવી ભરમાવી ભૂત ક..વાની અવનવિન છે, કે પોતાને માથે કુટતું ઠીકરૂં બીજાનાં માથે ઓઢાડી દેવામાં પ્રવિણ છો. આડકતરી રીતે કારસ્થાનો રચી કોમ કોમને વઢાડી મારવામાં કુશળ છો. કોઈ પણ લેખનો સીદ્ધો જવાબ ન દેતાં જગત ભડકાવી વઢાડવાની કળાજ રચો છો? વિરા! શાન્ત થજો! થોડું લખ્યું ઘણું કરી માનજો! છેવટ એમા જય નથી!!

realpatidar.com

શ્રી નિષ્કલંકીનાથ સર્વને શુબુદ્ધિ આપો,

લી० શુભેચ્છક (ખાકી)

https://archive.org/details/bk076/page/n4/mode/1up

realpatidar.com

ॐ

શ્રી. નારણ રામજીનો પ્રતિ ધ્વની.

वेद्वद्भिः सेवितः सद्भिर्नित्यम् द्वेष रागिभिः।
हृदयेनाभ्युनुज्ञातोयो धर्मस्तंनिबोधत् ॥

मनुस्मृती

દ્વેષ અને રાગ વિનાના અને વેદોનું રહસ્ય જાણવા-વાળા સજ્જન પુરૂષોએ સંશય રહિત હૃદયથી જાણેલો અને વ્યવહારમાં મુકેલો તેજ ધર્મ કહેવાય.

શ્રી. નારણ રામજીનો ઘણા વર્ષથી જ્ઞાતિએ બહિષ્કાર કરેલો ત્યારથી જ્ઞાતિ અને ધર્મનો શત્રુ બની ગલીચ ભાષાએ લેખો અને ભાષણોદ્વારા હુમલા કરેજ જાય છે. સત્પંથિયોને ધર્મ આજ્ઞા વાદ વિવાદ માટે મનાઈ કરે છે. સાચો જૂઠો ન કરવો વાદ” એને એ મહાન જીત માની રાવણશાહી દેખાડતાં વસ્ત્રનું ભાન પણ ભૂલે છે. તેઓ સહ કુપંનીને કેટલીક સૂચનો લેખો વિષે પ્રથમ અપાઈ છે. તેઓનાં લેખોની શયલીનુ અનુકરણ કરવામાં આવે તો સભ્યતાનો નાશ થાએજ. જવાબ એક બાજુએ છે, ફક્ત તેમના ઘણા વર્ષની કારકીર્દીનાં છેલ્લા લેખની આંખી કરાવનાર લેખથી તેઓ ભડકી એકદમ ઈલેકટ્રીક પાવરમાં પસાર થઈ, અનેક પ્રકારની ધમકીઓ, બ્હીવરામણીઓ

realpatidar.com

https://archive.org/details/bk076/page/n5/mode/1up

1980 - Narayan Ramjino Pratidhwani (76)

realpatidar.com

આપવા મંડી પડયા. તેથી એ ન ધરાતાં અન્ય કોમોને 'મ્હારી' શત્રુ બનાવરાવા ઉશ્કેરણી કરી રહ્યા છે, સબુર! સબુર! હજુ તો આગળ ઘણું છે. આ તો તમારા છેલ્લા વર્ષના રેકર્ડોનું એકજ પોટકું છેટે છૂટયું છે! સન્મુખ મુકાયું નથી, તેટલામાં આટલા બેહચક બની મગજ ખોઈ બેઠા! તો પ્રથમ વિચારી સંગ્રહ કરવું હતું? બોલ્યા પછી સાંભળવાનો સમય તો આવે જ! જ્યારે તમારા અસંખ્ય ગાંસડા પોટલા છાતીએ ઉકેલાશે, ત્યારે તમારી કેવી સ્થીતી થશે? તેની દયા આવે છે.

મી. વસંતને ભરમાવી ભૂત કરવામાં આપની જાદુઈ કળા અવનવિન છે, સત્પંથના ભેદુ થવા પ્રશ્ન કરવા પહેલાં પ્રશ્નોપનિષત્ શ્લો. ૨; વાંચો" તે પ્રમાણે અધિકાર મેળવી પછી આવો, તથા પ્રશ્ન [૩] નો શ્લો. ૨ જૂઓ, કે બ્રહ્મીષ્ટ થયા વિના સમજાવી શકાશે નહિ.

સત્પંથ મનુષ્ય માત્ર ભાઈચારે વર્તે તે જોવા ઉદ્દેશે છે, અવતારી પુરુષોને દેશ, જ્ઞાતી, ભાષાદિ ભેદો તજી સરખાં પૂજ્ય મનાવરાવે છે, કોઇને પણ હલકા ભારી નહિ માનવાનું સમજાવે છે જૂવો અથર્વવેદ કાં. ૧૩ મં. ૧૬–૨૧" "યજુર્વેદ અ. ૨૬ મં. ૨" એને તમે ભયંકર કારસ્થાન માન્યું છે? ભાષા દેશ, વેષના ખાર વ્હેરે કલેશ ઉપજાવવાની ધાંધલ કરનારા, સુલેહ સંપના ધર્મને માનનારાઓનાં શત્રુ થાયેજ.

realpatidar.com

તમારી કોમને નિર્માલાદિ દુષ્ટ વિશેષણો આપી

https://archive.org/details/bk076/page/n6/mode/1up

1980 - Narayan Ramjino Pratidhwani (76)

realpatidar.com

વગોવી ઉશ્કેરી જગતની શાન્તીનો ભંગ કરવા ઇચ્છો છો, તેજ તમારી કોમનું ભયંકર દ્રોહ કરી રહ્યા છો. નાટકો સીનેમાઓમાં બોધદાયક ચારિત્રો દોરી સંપને સુધારાનો પ્રચાર કરે છે, તેથી કલ્હે પીપાશુઓનાં પોકળ પાધરા થઈ જાય છે. જેથી તેઓ તેને ધિક્કારે છે.

સત્પંથ કોઈ પણ દેવની નિંદા કરવા કહેતોજ નથી. તેનો સર્વ દેવને નમસ્કારનો મહાન સુત્ર પ્રગટ છે. તે સર્વ પવિત્ર પુરૂષોને સરખા મનાવનાર હોવાથી દ્વેષિઓ તેને ભેળશેળીઓ, અર્ધદગ્ધાદિ નામો આપી નિંદા કરે છે. સત્પંથ જીવદયા ઉત્તમ પ્રકારે પળાવે છે, "માર કહ્યાનો દોષ છે, માર કહેતાં મરી જાય, જીવહિંસા કર્યાનો પાપ છે, તે જીવ નીશ્ચે નરકે જાય." "મુખથી માર ના કહેવું લગાર." "લીલું ઝાડ ના ભાંગવું પ્રાણી" પ્રભાતે ફુલ ચુંટયાનો છે મહાદોષ' જીવતો જીવ ન મારવો જાણી' ગળીનાં વસ્ત્ર પહેરવાં નહિ,' "દુધ દેનારી તે માતા તેના પરીવારને 'કુટુંબ' માનવો." એવી ઘણી આજ્ઞાઓ છે. જવાબમાં જોશો.

'બુદ્ધા અવતાર'ની કથામાં જીવદયાનો ઘણો સચોટ વર્ણન છે, ફકત એક જગાએ ગૌમેધની કથા આવે છે, તે ગુરૂહત્યાનો દોષ ઉતરાવવાના પ્રસંગાર્થે કરાવ્યો, કોઈ માંસ ખાવાર્થે નહિ. આખા સત્પંથ શાસ્ત્રોમાં આ એક ઠેકાણા વગર બીજી કોઈ પણ જગ્યાએ એવી વાત આવતી નથી. પ્રયોગ પ્રાયશ્ચિતનો પૂરો થયા કેડે તુર્ત ગાય શ્રીજીએ

realpatidar.com

https://archive.org/details/bk076/page/n7/mode/1up

realpatidar.com

જીવતી કરી દીધી. ગાય પણ સ્વર્ગ લોકથી મંગાવી હતી, આ જગતની ગાય નહોતી ફક્ત દેખાવ માટેનુંજ કાર્ય હતું, આવા સુક્ષમ વિષયને ભયંકર સ્વરૂપ આપી હિમાલય ઉથલાવી નાખ્યો ! જે ધર્મ પુસ્તકોમાં ઠેરઠેર ગૌમાંસ ભક્ષ, ગૌવધાદિ, ગૌ સુળીયે જીવતી ચડાવી શેકી ખાવી, 'શ્રાદ્ધમાં પણ માંસ જરૂર જોઇએ' એવી અગત્યની ફરજ પાડેલ હોય, તેવાને શું કહેશો ? પાણ્ડવના સમય પહેલાંથી ગૌમેધનો પ્રચાર હતો ઋષિમુનિયો છુટથી ગૌમાંસ ખાતા હતા, વેદો, બ્રાહ્મણ, યોગ, દર્શન, પુરાણ, ઇતિહાશાદિ ગ્રંથોમાં પુષ્કળ પ્રમાણ છે, 'યજ્ઞ' નો વાચક મૂળ શબ્દ 'મેધ' છે 'મેધ' ધાતુથી થયો છે, તેનો અર્થ મારવું, ઠાર કરવું થાય છે. હવન કરવા માટેજ પ્રાણી કાપી બળી આપવાનો તેની જાતી ઉપરથી તે યજ્ઞને અર્થ વ્યંજક (અર્થ જણાવનારૂં) એવું નામ આપતા. જે યજ્ઞમાં પુરૂષ કાપી બળી આપે તે 'પુરૂષ મેધ,' પુરૂષ મેધનો એક પ્રકાર યજુર્વેદ તૈત્તિરીય શાખામાં તથા શુક્લ યજુર્વેદમાં છે. ઘોડાનો બળી આપે છે. તે અશ્વમેધ, ગાયાદિનો બળી આપે તે ગૌમેધાદિ કહેવાય.

ઇતિહાસાદિક ગ્રંથો શોધતા સ્પષ્ટ જણાય છે કે પૂર્વે ગૌ માંસના ભોજનમાંજ આદરસત્કાર સમાઈ રહ્યો હતો, સન્માનિય અતિથી માટે તો. સુદામ ગાયો કાપવાનો કિંવા મધુપાર્ક કરવાનો ચાલ હતો. પ્રથમ અતિથીને મદ્ય પીવા આપી પછી તેને નિમત્તે ગાય કાપીને તેનું

realpatidar.com

https://archive.org/details/bk076/page/n8/mode/1up

1980 - Narayan Ramjino Pratidhwani (76)

realpatidar.com

માંસ રાંધીને ભેળી થએલ મંડળી ભક્ષ કરતી, તેથી અતિથિને ગોઘ્ન કહેતા. "જેને માટે ગાય કાપવામાં આવે તે ગૌઘ્ન" એવી વ્યુત્પતિ પાણીનીએ આપેલી છે. દાસ ગો ઘ્નૌ સમ્પ્રદાને" પાણીની મુનિ પણ તેજ સમયે હતા, "હઠ યોગ પ્રદીપિકા" અ૦ ૩, ઉ. गोमांसभक्षयन्नित्यं, पिबेद् मर वारुणीम, कुलीनं तमहं मन्ये, चेतरे कल घातका। ૪૭ ॥ गो शब्दे नोदिता जिह्वा तत्प्रेवशे हिता लुनि गोमांस भक्षणंतचुमहापात्तक नाशनम ॥ ૪૮ ॥ बृहदारण्यको-पनिषदનાં અંતમાં चछेत्पुत्रो मेपाण्डितोभिमीतः થી એ ત્રણ મંત્રો માંસ ખાવાની જરૂરીયાતની આજ્ઞા કરે છે.' એજ શબ્દો 'शतपथ ब्राह्मण' કા. ૧૪ માં છે." गरुड पुराण અ. ૯૬, શ્રાદ્ધમાં માંસ વારૂણી ખાય તો સીધો સ્વર્ગમાં જાય." कूर्म पुराण અ. ૧૬, માં દેવો બ્રાહ્મણોને ધરાવીને માંસ ખાય તો દોશ નથી.' देवी पुराण માં ૮–૯, ના દિવસોમાં નિવેધ દઈ માંસ ભક્ષણનું વીધાન કહેલું, ને' याज्ञवल्क्य स्मृति, માં માણસ માંદો હોય, કે શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ખવરાવીને, કે દેવો તથા પિતરોને ધરાવીને માંસ ખાનારને દોષ નથી,' 'एत्रीय ब्राह्मण' ૨–૯–૬માં માંસ ખાવાની આજ્ઞા છે "બ્રાહ્મણ વાકય अग्निशोमीयं पशुमांलमेत, આદિ મંત્રોથી યજ્ઞમાં પશુઓ મારવા અશ્વમેધ, ગૌમેધાદિ લખ્યું છે, ઋગ્વેદ ૨–૧૬૨. તથા, ૧૧–૧૨–૧૩–૧૮–૨૦–૨૧. મનુસ્મૃતિ, અ. ૧૧ માં અશ્વ-મેધ સૌ યજ્ઞોનો રાજા છે !' અશ્વમેધ યજ્ઞ વિધિમાં એક

realpatidar.com

https://archive.org/details/bk076/page/n9/mode/1up

realpatidar.com

અશ્વમેધમાં ૯ ગાયોનો હવી આપવાની વિધિ કરવાનું લખેલ છે. બીજા ૧૮ પાલક પશુ, ૨૬૦, વન પશુ લાવી યજ્ઞનાં થંભે બાંધવા ! સ્વર્ગમાં દૂધ મળે, વાટમાં ગૌમાંસનું ભાથું ગૌમાંસનો રસ મળે, તે માટે મરેલા મરદા સાથે ગાય કાપીને કાં જીવતી બાંધી બાળવામાં આવતી.' આ વિધિને 'અનુસ્તરણી' કહે છે. ઉત્તર રામચરિત્રમાં સન્માન્ય ને વૃદ્ધ 'કવિ વાલ્મિકીએ વશિષ્ટ ઋષીની આગતા સ્વાગતા કરવા પુષ્કળ ગોવત્સ કાપ્યા. વશીષ્ઠનાં આશ્રમમાં વિશ્વામીત્ર ઋષી, જનક, શતાનંદ, જમદગ્નિ, વિગેરે ગયા. ત્યારે તેમણે ગાયના વાછડા મારી પરોણા ચાકરી કરી, "ઋગ્વેદ અ. ૧ અ. ૪. વ. ૨૯ માં ગાય કાપવાની વાત લખી છે.' ઋગ્વેદ અ. ૨ અ૦ ૩ માં ગાયો મારવાની વાત છે તથા ૨૨ મ. ૧. અ. ૨૨ સુ. ૧૬૪ મ. ૪૩ માં ગાયોનો વાડો જોયો તેમાં અગ્નિ હોવાથી તે વડે ચિત્રવિચિત્ર બળદોને શૂરા પુરૂષો રાંધતા હતા. તેનો હવીલીંગ દેવોને અર્પણ કરતા હતા." પુનાની સરકારી હાઈસ્કુલના પ્રિન્સિપાલ મી. મહાદેવ મોરેશ્વર કુટે બી. એ. એમણે ષટ દર્શન ચિંતનિકા' માસિક ચલાવ્યું હતું ? તેમણે અંગ્રેજી પુસ્તક Thevicis situ leso fatyathei vilza tionin India.' લખ્યું. તેને માટે ઈનામ મળ્યું છે. તેમાં પરોણાની આગતા સ્વાગતા કરવાનો મુખ્ય નિયમ હતો, તે માટે સુદામ ગાય કાપતા. 'ઋગ્વેદ ૧૦–૨૮–૩ માં ઈંદ્ર સોમ પી બળદ ને હરણનું માંસ ખાતો એમ છે.'

realpatidar.com

https://archive.org/details/bk076/page/n10/mode/1up

realpatidar.com

ગૌમેધ યજ્ઞની વિધિ તૈત્તિરીય બ્રાહ્મણમાં છે, તે ઇંદ્ર જાડા પગવાળી, વરૂણ અને વિષ્ણુને વાંઝણી, પુષણને કાળી, વાયુને એક વેતરની મિત્ર વરૂણને બેરંગી, રૂદ્રને લાલ રંગની, સૂર્યને ધોળી ગાય ને વાંઝણી જોઈએ.' જેને માટે નામાંકિત થવું હોય, તે પંચસારદીયસવ=પાંચ પાંચ વર્ષનું યજ્ઞ કરતા. તેમાં સત્તર જુવાન ગાયોનો હોમ કરતા.' 'અશ્વલાયન ગ્રહ સુત્રમાં સુલગવ નામે યજ્ઞ કહેલું છે. તેમાં ગાયને શુળી પર રાખી સેકવાની વિધિ લખી છે.' અથર્વવેદના ગોપદ બ્રાહ્મણમાં યજ્ઞમાં જે માણસ યજ્ઞમાં જુદા જુદા કામ કરતા, તેમને માંસનો ભાગ કેવો કેવો દેવો તે કહેલું છે. વડા ગોરને જીભ સુદ્ધાં બે જડબા દેવા આદિ છે' કાન્હડે જાતના બ્રાહ્મણોમાં વર્ષે એક વાર દેવીને માણસ બળી દેવાના કુળાચાર છે.' 'નરમેધ યજ્ઞમાં ૧૧ થાંભલા રોપતાં ને તે થાંભલે બળીની ગાયો ૧૧ બાંધતા. આ વિધિ યજુર્વેદની વાજસનેયી સંહિતામાં છે. 'કલી પુરાણમાં એક માણસનો બળી વિધિપૂર્વક આપ્યાથી ૧૦૦૦૦ ને ૩ નું બળી આપ્યાથી ૧ લાખ વર્ષ, દેવી તૃપ્ત રહે છે, સત્પંથ બ્રાહ્મણ, કા. ૧ રૂા. ૧૩ માં ગૌમાંસ ખાવાની આજ્ઞા કરી છે ? મનુસ્મૃતિના ત્રીજા અધ્યાયમાં શ્રાદ્ધ પક્ષમાં અસંખ્ય પશુ હત્યા વિષેનો લેખ છે. શ્રાદ્ધમાં અવશ્ય માંસ જોઇએ જ અણુમાત્ર પણ માંસ ના હોય તો શ્રાદ્ધ ના થાય ! તેવો ઉલ્લેખ છે.' નિર્ણયસિંધુ ૫૦૩ માં શ્રાદ્ધમાં માંસ વિના ચાલે જ નહિ, ને અસંખ્ય હત્યાઓનું

realpatidar.com

https://archive.org/details/bk076/page/n11/mode/1up

realpatidar.com

વિધાન છે. (મતસ્ય પુરાણમાં પિતરને ગમતા પદાર્થોમાં ઘીને માંસ ગાયનું કહેલ છે.' 'કેશવનું કહેવું પણ એજ છે' 'માંસ વિના પિતરૂ તૃપ્ત થાય જ નહિ', એવી એવી અસંખ્ય આજ્ઞાઓ એ 'ધર્મ' પુસ્તકો કરી રહ્યા છે. (જવાબમાં જોશો)

સત્પંથ શાસ્ત્રમાં એક અણું માત્ર હત્યાની વાત ઉપર લોટપોટ થઈ આટલો ભવેડો કરી કૂદયા ! પણ 'આ' ઢગલાબંધ અસંખ્ય વાતો સાંભળી વસંતજી ! હોળી લાવશો ? કે ભડકો ? સુગ માંસની હતી ? કે સત્યની ? માંસની સુગ હોય તો, સુગ પૂરે પૂરી અહીં ઉતારવાની છે. અરેરે !!! ગાય જીવતી સુળીએ ચડાવી શેકી ખાતાં જરાએ દયા તમારા બ્રાહ્મણોને નહિ આવતી હોય ? કહો; માંસાહારી મલેચ્છ કીયા ? એવા હત્યાકાન્ડનાં પુસ્તકોને માનનારા જીવદયાના મહાન સુત્ર ચર્ચાવનાર સત્પંથનાં પુસ્તકોની નિંદા કેમ ન કરે ? લજાઈ મરો !!! વસંત ભાઈ ! હોળી દિવાળી ભેળી ન કરી નાંખો ! સત્પંથ દયા, ક્ષમા, પ્રેમ, સમાનતા, સહનશિલતા શિખવે છે. તેવા પવિત્ર ધર્મનો દ્વેષ હિંસાવાદી ધર્મવાળા વિના બિજો કોણ કરે ??? કોમીવાદ તજાવનાર સત્પંથ છે.

ખોટી ગપ 'અમુક ગામોમાં કારસ્થાનો ચાલી રહ્યા' તે વિષયની લગી ! તે પહેલાં પોતાનું સંભાળ્યું છે ? ડાકોરાદિના કભાડાના કેસો કેવા ચાલે છે ? તમારા મહારાજો ને મહાત્માઓ કોર્ટમાં ઘસડાયા જ કરે છે. તે

realpatidar.com

https://archive.org/details/bk076/page/n12/mode/1up

realpatidar.com

વાત પ્રગટ કરવા તસ્તી ન લીધી ? લજ્યાહરણને કારસ્થાન તેનું નામ. સત્પંથનાં મંદિરોમાં તેવું નથી. તેમાં શ્રી નિષ્કલંકીનાથનું ભજન થાય છે. તેમના આગમનની પ્રતીક્ષા થાય છે, તેમનાં સ્વરૂપની લિલાનાં ગુણ ગાન ગવાય છે. ખાર, ઝેર, ઈર્ષાદિ તજાવવાનાં દરેક પ્રયોગો અજમાયા જાય છે. એ પવિત્ર પ્રયોગો કલેહ પિપાશુઓને ભયંકર કારસ્થાન લાગે ! ને ડાકોરના મંદિરોની ચેષ્ટા તે ઠાકોરજીની લિલા લાગે !

તમારા ધાર્મિક સમૂહો પગારદાર નોકરોથી કુસંપના પીપાશુઓ સ્વમતનો પડઘો પાડવા કેવી કેવી કપટ ચર્ચા કરે જ જાય છે ? તે ભૂલી જઈ સત્પંથી સત્ય પ્રચારવા પ્રમાર્થ સેવા કરે તેની નિંદા કરવા આડુંડોડું બતાવો છો ? વસંત દુનિયાની ખાતર ધર્મ ના ખૂવો !

સત્પંથમાં સ્વર્ગ છે, તમારે ત્યાં ભલે નર્કજ રહે. સત્પંથના સ્વર્ગનું વર્ણન વેદ કરે છે. અથર્વ વેદ કા. ૧૦ અ. ૪ વ. ૨૨ મ. ૧૦, આ લોકમાં જેમ ભંડારાદિ છે, તેમ બ્રહ્મલોકમાં જાણજો. આ લોકનાં જુઠા બ્રહ્મ લોકમાં સાચા (અખંડ) અપાર છે. અસંખ્ય મોટા થાંભલા (વાલા મહેલો) છે. દેવો પાસે છે, ત્યાં પોતાનું કોણ ? હજારો દેવાંગનાવાળુ સ્વર્ગ છે. તતરીય ઉપનિષદ્ ૮ અનું તેયેશતં પ્રજાપતે સ નંદાઃ વાળો મંત્ર. એ વિના બીજા ઘણા પ્રમાણો છે. (જવાબમાં જોશો).

realpatidar.com

નુર (અમૃત) પીવરાવી સત્પંથે જગતને પાવન કર્યું

https://archive.org/details/bk076/page/n13/mode/1up

realpatidar.com

છે. ગોળીમાં બધા પવિત્ર દ્રવ્યો જ મેળવેલા છે. તમારી નેમ પવિત્ર ને ભ્રષ્ટ કહેવાની છે. તે નેમ શુદ્ધ પણાની હોય તો ગોળીમાં ભ્રષ્ટ કરનાર પદાર્થ પ્રગટ સિદ્ધ કરી આપો ? વર્ણશંકર પણાનો અંશ હશે તો સિદ્ધ નહિ કરી શકો ! દરેક મંદિરોમાં ને દેવસ્થાનોમાં મૂર્તિઓને કાં પ્રતક્ષ ગુરૂ ચરણને નહરાવી ચરણામૃત લે છે. કૃષ્ણ જન્મ તિથિએ તો ઠાકોરજીનું ચિકીંન શ્રદ્ધાળુઓ પ્રેમથી પ્રસાદી માની ખાઈ આનંદ માને છે. તેનો દોષ મનાતો નથી ? ને શ્રી સદ્ગોરનાં અવસાન સ્થાન ને ધોઈ ચંદનાદિ પવિત્ર દ્રવ્યો મેળવેલ ચરણામૃતની નિંદા ? એ ઇર્ષાવિના બીજુ શું ? ગુરૂગિતા ગંગા કહે છે.

પ્રમાત્માને ભજવાનો કોઈ ભાષાએ કંટ્રાક લીધો હોય તો પ્રગટ કરો ! અમુક જ ભાષાએ પ્રમાત્મા પ્રસન્ન થાશે ? તેમ હોય તો તે બતાવો ! પછી દુઆ, દસ્તરી ગાયત્રી આદિની નિંદા કરો ! ! કલિયુગમાં કઈ ભાષા માન્ય થઈ છે ? તે જુઓ 'ભવિષ્ય પુરાણ' ઉત્તરાર્ધ ખં. ૩ અ. ૧ + ૫ થી થોડુંક આગળ × × 'કલિયુગમાં યાવની ભાષાનાં મંત્રોથી જ્ઞાન મળશે, યાવની ભાષા મોક્ષદાઈ હોશે.' વસંત ! હોળી સળગી ! જાઓ, જાઓ ! દોડો, દોડો, ઓલવો ! ભવિષ્ય પુરાણ લખનારને અટકાવો, શાન્ત થાવ, હજુ એ વિનાં ઘણા પ્રમાણો છે (જવાબમાં જોશો).

realpatidar.com

તમારા જાહેર ચેલેંજમાં વઢાડી મારવાની કુતર્ક

https://archive.org/details/bk076/page/n14/mode/1up

realpatidar.com

વિના બીજું કાંઈ વજુદ નથી. પક્ષપાતી થાઓ, ખાર, ઝ્હેર વધારો એટલું છે. સત્પંથ દરેક સમયની આકાશવાણી (અપુરુષવાણી) ને એક સરખી રીતે માનવાનું શીખવાડે છે, છેલ્લી વાણીને પ્રધાનપદે મનાવરાવે છે. જ્ઞાનદેવા પરમાત્માનાં મુખ્ય અંશાવાળા શરીરે મનુષ્યરૂપે પ્રત્યક્ષ પધારે તેને જાત, ભાષા, દેશ વેશના ભેદાદિ ભૂલી; મોહ, ખાર, ઝ્હેર ખોઈ ચરણે શિષ નમાવવા શિખવે છે. તમે ભલે નવા નવા જૂનાની ગણત્રી કે જાત ભાષાદિના ભેદમાં ગુંચવાઈ શ્રી નિષ્કલંકી નારાયણની નિંદા કરો સત્પંથ ઈશ્વરીવાણી અનુસાર છે. તેને ચાહે તેમ કહેવાથી તમારૂં ચેલેંજ ત્યાંજ ઉભું, ઉભુ સુકાઈ રહેશે.

તમે જ્ઞાતિ શત્રુ બની, કલેહ પ્રચારવાની ફરજ ધારી લીધી છે. સંત્પથીયો વેદ વચને શ્રી નિષ્કલંકી નાથનાં ચરણમાં રહી સંપ સાધવા મથે છે. તમો ઈર્ષાને દ્વેષના ફંદામાં ફસાયા છો, સત્પંથી શ્રી નિષ્કલંકીના પ્રેમમાં રચ્યા પચ્યા છે. તમારી એવી નિંદાઓથી સત્પંથનો ખુલાશો નહિ મેળવી શકો ! સત્પંથ શીખવું હોય તો નિર્ભીમાની થઈ કાળ, ક્રોધ ત્યાગી કોઈ સત્પંથીની સેવા કરો. જુઓ "મુંડકોપનિષત્" મું. ૩–૨–મં–૧૦.

સત્પંથનાં પુસ્તકો ક્યાં સંતાડેલા છે ? અસંખ્ય પ્રતો લખેલી વિદ્યમાન છે, તમારા છો મુદ્દા તો શું ? પણ સઘળુએ ઈર્ષાને દ્વેષની ગોઠવણ છે. છ મુદ્દા પહેલાં આ છ 'ભેદ ભાંજગો' વાંચી લો !

realpatidar.com

https://archive.org/details/bk076/page/n15/mode/1up

realpatidar.com

(૧) 'પીરાણા' ગામનું નામ છે, તે નામ ધર્મનું નથી. ધર્મનું નામ 'સત્પંથ' છે, તેની સાથે કોઈ પણ શબ્દનો સમાવેશ થતો નથી. તે ઈશ્વરી ધર્મ છે. તેમાં વાદવિવાદાદિ કે ટોળાની અગત્ય નથી. સત્પંથના મુળ સ્થાપક શ્રી પુરૂષોત્તમનારાયણ આદ્ય પુરૂષ છે. જેની અજ્ઞાએ જગત ઉત્પન્ન થયું છે, તે પંથે સંવત ૧૫૦૫ માં શ્રી સદ્દગોર પીર ઈમામશાહ રૂપે ગુજરાતાદિએ પધારી પ્રચાર કર્યો તે મુળ સ્થાપક ના કહેવાય, તેઓશ્રી નિઝરાદિશાખા, એવા સંકોચાએલા મતના નહોતા, તેઓશ્રીનો દરેક શબ્દ વેદાનુંકુળ છે. તેઓ પોતાના સમયમાં કોઈપણ પક્ષવાદિના દાઈ કે મીશ્નરી, (તાંગેદાર) નહોતા. તેઓશ્રી સત્પંથના દાતાર, નોકર નહી પણ સરદાર, સેવક નહિ પણ ધણી, સૃષ્ટિના ગોર સદગોર બ્રહ્મા. મનુષ્ય રૂપે હતા. સષ્ટિનાગોરની પદ્વિ ત્યારે જ મળે છે, કે વર્તમાન કાળનું સોળ કળાવાન શ્રી વિષ્ણુનું શરીર જ્યારે શિષ્ય થાય છે. તેઓશ્રીએ ઘણી ભાષા માંહેલી ઇશ્વરી વાણી સુગમ કરી, તેનાં મુળ રહસ્યો સહીત સમજાવી છે. તેઓએ કોઈ પણ ગ્રંથ કે વાણીમાં રંચ માત્ર હેરફેર કર્યો નથી. તે સિદ્ધ કરવા ઘણા જુના પુસ્તકો સિંધી, ગુજરાતી અક્ષરોનાં મેળવી શકાય તેમ છે, તેથી ખાત્રી કરી શકો છો ! જૂઠી વડાઈની 'ડીંગ' ઠોકેથી વસંતનાં ફાગ ગણાશે ? સત્પંથથી નોખી પડનારી સાખા પોતાના માટે નામ ઠામ, જ્ઞાનાદિ ગમે તેમ નોખું દેખાડવા ફેરવે, તેમાં તેનું તે જાણે ! તમો પણ તેઓનાં કારસ્થાનનાં મોહમાં પડી ભ્રમે ભૂલી કાચું કાપ્યું છે.

realpatidar.com

https://archive.org/details/bk076/page/n16/mode/1up

1980 - Narayan Ramjino Pratidhwani (76)

realpatidar.com

(૨. ઇસ્લામી ધર્મમાં મવલાનાં હશનબશરી, મવલાના રૂમી જેવા મહાન સુફી (બ્રહ્મજ્ઞાની) મહાપુરૂષો જેઓ શરીઅતની પદ્ધીથી આગળ વધી હકીકત (જ્ઞાન) મેળવી મોક્ષાધિકારી થયેલ, તેઓના વચનામૃતો વિદ્યમાન છે. જુઓ! અવતારવાદ અને ઘટપાટનો કેવી રીતે સત્કાર કર્યો છે? મવલાના હશનબશરી સાહેબ શ્રી અલીના શિષ્ય થયા તે સમયનો 'સંગ અશવદના પરછાનો વિષય' ઘટપાટને લગતો, અને મવલાના રૂમીના વચનામૃત 'મિશ્લે રબઆ બારહા રોઇદે એમ' અવતારવાદને અનુકુળ છે. તે વિષે કોઈ પણ સજ્જન ઇન્કાર નહિ કરી શકે. ઘણા પ્રમાણો જવાબમાં જોશો.

૩. સત્પંથ શાસ્ત્રનો શબ્દે શબ્દ વેદાનુકુળ છે. તે વિષેની ટુંકમાહેતી સત્પંથ સંબંધિ નિવેદનમાં જોઈ લો! ને "कलितारक मंत्रम" નામનું પુસ્તક વાંચો, શિક્ષાપત્રી પણ સાથ આપશે.

૪. અતિશયોક્તિભર્યા વિષયો વેદોમાં ઓછા નથી. એકલદ્રશીને નાં સૂજે! 'વૃત્રને સૂરેન્દ્રનું વજ્જન અડી ન શકયું! તો તેને મારવા બ્રહ્મહત્યા કરી એકબ્રાહ્મણનું પાંશળુ કાઢી તેથી વૃત્રને માર્યો!' 'અગસ્તઋષિ સર્વ સમુદ્ર પી ગયા!' આદિ ઘણા પ્રમાણો ગપગેજેટ જેવા નજરે આવશે, તે તેનાંભેદુને ભાવે, પણ ઉપલેકિયા રહ્યા માથું કુટે! એવા ભેદોવાલા ગુઢાર્થોમાં જ વેદામૃત સમાઈ રહ્યું છે' એજ સત્પંથ શાસ્ત્રનો મહિમા છે.

realpatidar.com

https://archive.org/details/bk076/page/n17/mode/1up

realpatidar.com

કુપને ઝેરી કહેનારને પાણી મીઠું ન લાગે ! શ્રી સદ્‌ગોર ઈમામશાહ બાવાને શતરૂ માનનાર તેની વંશનો મિત્ર કયાંથી હોશે ? ઈર્ષા ખોરાઓ ગમે તેમ લખે ! તેથી શ્રીજી બદલાશે નહિ સત્પંથમાં જન્મેલા, સત્પંથી કહેવરાવનાર જેટલા છે, તેઓ સત્પંથ વિના બીજું શું પાલશે ? શ્રી સદ્‌ગોરના પૂત્રો તેની અવજ્ઞા નહિ કરે, તકરારની ખાતર માનોકે એક જ શરીરનાં સર્વ અવ્યવો સરખા નથી, તો શરીર મિથ્યા થાતું નથી. તમારી જ સંપ્રદાયનાં (હુકાની ટોળીના) સઘળાં માણસો એક સરખા નહિ હોવાથી ખોટી કહેશો ?

૫. ધર્મ પ્રવર્તકોએ વેદાનકુળ વર્તન કરાવ્યું છે. વેદને જુઠું કહેનાર, સત્પંથને જુઠો કહી શકે છે. અનધિકારીને વેદનું મહાન રહસ્ય ન આપવું જોઈએ. 'યજુરવેદ અ૦ ૧૭ મ૦ મહેનત પડે કે પ્રાણનાં ભયને સમે ન બોલવું, સત્યવાત પોતાની મેળે થવાની છે. અ૦ વે૦ પાણીમંત્રી શ્રદ્ધાથી અધીકાર આપો, પોતાનાજ ધૈર્યે ગુપ્ત યજ્ઞથી દિક્ષા લઈ ઉન્નતી પામો ત્રણે લોકમાં એ જ નિધાન છે.' 'શ્રીમદ્ ભાગવત અ૦ ૧ શુકદેવજીને સ્વર્ગનાં દેવોએ સ્વર્ગનું અમૃત ભેટ કરી ભાગવત સાંભળવા વીનતી કરી. દેવોને ભક્તિહીણ કહી હાંશી કરી કાઢી મૂકયા, ને ભાગવત ન સંભળાવી.' એ પ્રમાણે સત્પંથ માટે જ છે. સત્પંથને સંતાડી રાખ્યો હોત તો ૪ થી ૫ લાખ સત્પંથીની સંખ્યા કેમ રહે તે ? ઉત્તમ વસ્તુ મેળવતાં મોંઘી પડે છે, જેથી

https://archive.org/details/bk076/page/n18/mode/1up

realpatidar.com

કાહેરા કંટાળી નાશી જાય છે. મોતી લેવા મોત આગમનારા દરીયામાં ડુબકી મારે છે, શંખલાના ગ્રાહકો કાંઠેથી ગાડા ભરે છે.

સત્પંથ પાળવો સહેલ નથી. સત્પંથ આને કહ્યો છે. જુઓ! સત્પંથનું સ્વરૂપ. ૧ ટેક, ૨ પ્રતિજ્ઞા, ૩ નિયમ.

૧ ટેક=સત્ય, પુરૂષાર્થ, પ્રેમ; સમાનભાવ, ક્ષમા

૨ પ્રતિજ્ઞા=સર્વ નિયમોનું સેવન, બાળકોને સત્પંથી કેળવણી, અંધ શ્રદ્ધાનો ત્યાગ.

૩ નિયમ-શરિરશુદ્ધિ, હ્રદયશુદ્ધિ, વ્રત, ઉપાસના, ધ્યેય.

શરિરશુદ્ધિ=લાઈ સુતક (રજસ્વલાથી તે મરણ પર્યંતના સ્નાનાદિ પ્રયોગો) ઉતરાવવા તથા પાળવા.

હ્રદયશુદ્ધિ=માદક પદાર્થો (લસણ, ડુંગળી, હીંગ, તમાકુ, અફીન, ગાંજો, ભાંગ, તાડી, માંસ, મદિરા, ગળી, આદિ)નો ત્યાગ.

વ્રત=શુક્રવારી બીજ તથા દશાંશ પાળવી ને દેવી.

ઉપાસના=સંધ્યા ચારે વખતની તથા ઘટપાટની પૂજા.

ધ્યેય=શ્રી નિષ્કલંકી નારાયણ.

આ વેદ માન્ય ઉત્તમ શ્રેણીથી ઉત્તમ ને પવિત્ર બીજો નથી, એનેજ સત્પંથ માન્યો છે.

૬. સત્પંથની નેમ એક પુરૂષ શ્રી નિષ્કલંકી નારાયણની જ સેવા કરવાની છે. વેશ્યા વૃત્તિ ત્યાં નથી. કોઈની નિંદા કે અવગણના નથી. તમામ ધર્મને પોતાના માની સર્વ દેવને નમસ્કાર કરે છે, એ પ્રમાણે સત્પંથના સાત્વિક ભેદો આગળ તમારા છ એ સુદ્ધા રદ બાતલ છે.

realpatidar.com

Most of the information is mentioned with the intention of discrediting the Great Shri Narayan Ramji Limbani & his team and to demean the good work done by them in uplifting ther fellow caste members.
Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk076/page/n19/mode/1up

realpatidar.com

'વર્તમાન અવતારી પુરૂષની અવગણના કરી વિમુખ થનારા સર્વેશે' તમારે મન અવતાર પાત્રથી વિમુખ થઈ તેની અવગણના કરનારા હરણાકંશ, રાવણ, કંશ, દુર્યોધનાદિ પેઠે સુખી થાશે! એમ હશે તો તેમાં હમને શું? તમારા ભાવ તમે ભોગવશો.

કુરાને શરીફ આકાશવાણી હોવાથી તેનું અપમાન સત્પંથી કરી શકે જ નહિ. સ્વામિ રામતિર્થે ઘણા પ્રેમથી તેનાં યશોગાન કર્યા છે. યુગનું પ્રકાશ એને જ વર્ણવ્યો છે સત્પંથના મહાત્માશ્રી સદ્ગોર બ્રહ્મા પીર શમ્શ તબ્રેઝ સાહેબને શ્રી રામથી પણ વિશેષ કહ્યા છે. કુરાને શરીફ વિના બીજા ૧૦૩ પુસ્તકો અવારનવાર નોખી નોખી ભાષામાં ઉતરેલ ઇસ્લામી શાસ્ત્ર સ્વિકારે છે, તેમાં વેદોનો સમાવેશ થઈ જાય છે. શ્રી સદ્ગોર નબી મહમ્મદ સાહેબ પણ પોતાના માનેલા ધર્મનું નામ 'હનીફ'—સનાતન કહ્યુ છે. સંવત ૧૬૮૪–૮૫ હી૦ સ૦ ૧૦૫૭ માં દિલ્હીના મોલવી મગ્લાના અબ્દુર્રેહમાન ચિસ્તી સાહેબના પુસ્તક 'મિરાતુલ્મખ્લુકાત્'માં મહાદેવ બ્રહ્માને જગતના ઉત્પન્ન કરનાર પિતામહ વર્ણવ્યા છે હ૦ આદમની ઉત્પત્તિને જ મળતું બૂ૦ ઉ૦ અ૦ ૧. મં૦૨–૩ માં છે. 'નાશોખ ત્વારિખમાં (વેદ અને વેદ પહેલાનો વિષય વર્ણવ્યો છે') તે જૂઓ ખાત્રી થશે. શ્રી સદ્ગોર નબી મહમ્મદ સાહેબે 'આદમ' પહેલાં 'આદમ' અનુક્રમે સીત્તેરવાર ફરમાવ્યું હતું, શાસ્ત્રના ભેદો સમજવાના છે. હઠવાદ કરી વાદાવાદ

realpatidar.com

https://archive.org/details/bk076/page/n20/mode/1up

realpatidar.com

કરવાનું નથી. શ્રી સદ્‌ગોર ઈમામશાહ બાવાએ એ રીતે માન વધાર્યું છે. વિશેષ જવાબમાં જોશો !

શ્રી નરનાથ મહાન પવિત્ર 'શ્રી અલી' સાહેબનું નામ મોક્ષદાતાર મનાએલ છે તેઓશ્રી સ૦ ન૦ મહમ્મદ સાહેબની વાણી અને પવિત્ર કુરાને સ૦ નું સત્વ છે. જે કાગભુસંડીએ ગરૂડજીને શિખવાડેલું કે 'અબ પક્ષપાત કછુનાં રાખું, સંત પુરાણ વેદમત ભાંખું, xxxx સંવત વિક્રમ દધી અંગા, મહા કોકસ ચતર પતંગા,' આદિ ઘણા ભેદો વેદાદિશાસ્ત્રોથી મલે છે, સ્પષ્ટ શિખવું હોય તો કોઈ સત્પંથીની સોબત કરો. વિશેષ પ્રમાણ જવાબમાં જોશો.

પથ્થરાદિની મૂર્તિ પૂજવાનું વેદાદિ શાસ્ત્રો ના કહે છે, સત્પંથ તેજ શિખવાડે છે, વે૦ બ્રા૦ પુ૦ ભર્તૃહરી સતક, ગોરક્ષવાણ, કબીર. મીરાં નૃસિંહાદિની વાણી જુઓ, સાક્ષાત અવતાર પાત્રથી વિમુખ થઈ તેની અવગણના કરી પથ્થર મૂર્તિથી ભટકાવા કોણ જાગે ?

સત્પંથની અવગણના કરવામાં નિતિની હદ કુદાવી જવાની હિમ્મત શ્રી નારણજીએ અનહદ દેખાડી છે. તમારા માટે શ્રી નિષ્કલંકીનાથને પ્રાર્થું છું, કે શ્રીજી તમને દિવ્યચક્ષુ આપી સત્પંથ સમજવા ભાગ્યશાળી કરે. આ લેખથી નારણજીની કુંપની સહ સર્વ લેખોની સમાલોચના થઈ જાએ છે, એ સર્વેનાં લેખો એકજ સીશનમાં ઢાળેલા બીબાની પેઠે એક સરખા છે.

realpatidar.com

મી. નારણે હિન્દુને વટલાવનારાઓમાં સત્પંથીયોને

https://archive.org/details/bk076/page/n21/mode/1up

realpatidar.com

યોજી અજ્ઞાત કોમોને ભટકાવી મૂકવાની યુક્તિ કરી છે. સત્પંથી માંસાહારી નથી. માંસાહારીઓ શાસ્ત્રોકતનાં પ્રમાણો આગળ વાંચી ગયા, તેવાઓ વટાળે છે, સત્પંથ હિન્દનાં પુત્રોનો સંપ રાખી. અહિંસક થઈ શ્રી નિષ્કલંકી નામને ભજવાનું શિખવાડે છે, સત્પંથને બદલે "પીરાણા પંથ. લખનાર" અજ્ઞાત છે. પીરાણા ગામ હમણાં વસ્યું છે. સત્પંથ અનાદિનો છે. તે જાણ્યા છતાં દ્વેષનો પરદો નાખી ઢાંકી દેવાનું પ્રપંચ કર્યું છે.

સત્પંથ વેદોકત આચાર પાળવા લલચાવે છે તમારી પેઠે બારવટિયાની ટોળી બાંધી દ્વેષના બંધનો મજબુત કરવા પ્રેરતો નથી. તમારો હજી સુધી એક ધ્યેય નક્કી થયો નથી, ધર્મની ગાંઠ નક્કી પાડી નથી, લાગમાં આવે તે ધર્મમાં માથું ઘાલી દઈ આશરો લઈ લો છો. એનું જ નામ તે ખીચડિયો ધર્મ, કયાં સુધી કુંપની સહ રઝળી સરી અર્ધ દગ્ધ દશામાં રહેશો ? હમો શુદ્ધ સત્પંથી છીએ, હમારો ઇષ્ટદેવ એક છે, હમારૂં ધ્યેય ધ્યાન નિષ્કલંકી નાથ છે. હમારા પુસ્તકો એકજ મતલબના છે, જેથી હમે એકજ શુદ્ધ ધર્મિ છીએ. તમારૂં સ્થાન જયાં જાઓ ત્યાં નવું, તેથી ખીચડીયાપંથી બન્યાં ! અર્ધદગ્ધ હોવાથીજ જેને તેને સ્વ સ્વરૂપમાં જોઈ બોલાવો છો.

હિન્દમાં ઘણી કોમોને ઘણા ધર્મો પોતાને હિન્દુ કહેવરાવે છે ! તમોએ તેમાંથી કયો ધર્મ ? કયો સંપ્રદાય ? કયો વેદ ? કયા કયાં ગ્રંથો પ્રમાણ કરી માન્યા છે ?

realpatidar.com

https://archive.org/details/bk076/page/n22/mode/1up

realpatidar.com

કહેશો ? જ્યાં તમારૂં મૂળ નક્કી નથી થયું, ત્યાંસુધી તમને ખિચડિયા પંથી, કે અર્ધદગ્ધ વિના બીજું કાંઈ પણ કોઈ કહી શકશે નહિ ?

સત્પંથી શ્રી નિષ્કલંકી નાથના યશોગાનમાં ગુલતાન બનેલા છે. તેમને બીજા કોઈની સ્તુતિ કે નિંદાની દરકાર નથી. તમે તમારે શ્રી નિષ્કલંકીની શત્રુવટમાં ગમે તેટલી સાથે ધુળ ઘાલો. સત્પંથીયોની નિંદા કરો, દુઃખદો, સત્પંથિયો ઘણા યુગોના અનુભવી છે ! બી જાય તેમ નથી.

સત્પંથિયોને વાદાદિ ઝઘડાથી વેગળા રહેવા ફરમાવેલું હોવાથી તેઓ શાન્તીએ તમારી લિલાનું અવલોકન કરી રહ્યા છે. તમારા કરાંચીના કાર્યાલયથી જે પત્રો હમને મોકલવામાં આવેલા, તેની સૂચના જોગપત્ર હમે તુર્તમાં રવાના કર્યા છે. 'તેની તપસીલ'નો પત્ર કરાંચી યુવક મંડળનો આવ્યો. તા. ૧૧–૧૨–૧૮ને રોજ તેનો જવાબ તેજ તારીખે લખ્યો તેનો જવાબ કરાંચીની તા. ૨૪–૧૨–૧૮ નો આવ્યો, તેનો જવાબ પીરાણેથી તા. ૩૧–૧૨–૧૮ દાડે આવ્યો, તેનો જવાબ લખ્યો. કરાંચીથી તા. ૯–૧–૧૯૧૯નો લખેલ નીચે પ્રમાણેનો મળ્યો, કરાંચી તા. ૯–૧–૧૯૧૯ સૈયદ બાવાસાહેબ અહમદઅલી જોગ મુ. પીરાણા લખવાનું કે તમારો પત્ર તા. ૩૧–૧૨–૧૮નો લખેલો પોતો, વાંચી તમામ હકીકત જાણી, વીશેસમાં લખવાનું કે તમોએ તમારા લખેલા પત્રમાં જે અમોને સવાલ કરેલા છે, ને તેના જવાબ માગેલા છે, તો તે

realpatidar.com

https://archive.org/details/bk076/page/n23/mode/1up

1980 - Narayan Ramjino Pratidhwani (76)

realpatidar.com

જવાબ આપવાને અમો તમારા સાથે કોઈ પણ જાતથી બંધાએલા નથી. તેમ તમારે ને અમારે કોઈ પણ જાતનો સંબંધ નથી, જેથી તમને અમારી પાસેથી કાંઈ પણ જવાબ માંગવાને અખત્યાર નથી, તેમ અમો તમારા કોઈ પણ કામની અંદર આડે આવતા નથી, તો પછી તમને અમારા પાસેથી જવાબ લેવાને અખત્યાર પણ નથી, અને અમો પણ તમને જવાબ આપવાને બંધાએલા નથી. જેના સાથે અમોને સંબંધ છે, તે જો જવાબ માગશે તો તેનો જવાબ આપવાને અમો બંધાએલા છીએ, ને આપીશું. બાકી તમારે અમને આજથી કોઈ પણ દિવસ પત્ર વહેવાર લખવો નહિ. તે લખશો તો અમો તેની દરકાર પણ કરીશું નહિ માટે હવે ટુંકમાં સમજી પત્ર વ્યવહાર કરવો નહિ. એજ લી. શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડલ તરફથી મુ. કરાંચી બંદર, રણછોડ લેન ! આ જવાબની માગણી માટે તા. ૧૩-૧-૧૯ સે પત્ર લખ્યો" તેનો જવાબ ન આવ્યો તો હમે જાણ્યું કે સંતોષ થયો હશે ! 'પડી ટેવ નં ટળે, પાછો તા. ૬-૪-૧૯ સે પત્ર રજીસ્ટર કરી હમને મોકલ્યો ? તેનો જવાબ તેજ દિવસે રવાના કર્યો ? તેનો જવાબ કરાંચીનો તા. ૧૪-૬-૧૯નો મળ્યો તેનો જવાબ તા. ૨૦-૬-૧૯ સે મોકલ્યો. કેટલોક સમય કંપનીના દ્વાર બંધ રહ્યા. પણ તા. ૧-૭-૩૦ સે બે હેન્ડબીલો મોકલ્યા ' તેનો જવાબ તા. ૧૨-૭-૨૦ સે રવાના કર્યો, તેનો જવાબ ન આવ્યો. તા. ૧૪-૯-૨૦નો મી. રત્નસિંહ શિવજીનો જવાબ આવ્યો. તે નીચે મુજબ,

realpatidar.com

Most of the information is mentioned with the intention of discrediting the Great Shri Narayan Ramji Limbani & his team and to demean the good work done by them in uplifting ther fellow caste members.
Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk076/page/n24/mode/1up

realpatidar.com

"કરાંચી તા. ૧૪–૯–૨૦ થી માન સઈયદ બાવા સાહેબ એહમદઅલી જોગ. લખવાનું કે તમારો કૃપાપત્ર મને કાલરોજ મલ્યો તે વાંચીને સાંજના તેના સેક્રેટરી અને પ્રમુખને હું મલ્યોને કહ્યું, કે તમો સઈયદ બાવા સાહેબને કાગળ લખ્યો, પણ તેને પોતો નથી, તેથી તારે બીજી વખતે લખી મોકલો તો તે જવાબ આપે. એમ મેં કહ્યું. ત્યારે તેણે કહ્યું કે અમો એવા નવરા નથી કે રોજ, રોજ બાવા સાહેબને કાગળ લખતા રહીએ. પોતે તપાસ કરીને જો તે કાગળ મેલવી વાંચી લે તો ભલે નકા તે જાણે. અમારી તો લખે છે બલાય. એ સાંભળીને મને એકદમ ગુસ્સો આવ્યો......વગેરે મતલબનો આવ્યો. તેનો જવાબ તા. ૨૧–૯–૨૦ હમોએ તપાસ કરી પણ પત્ર મલ્યો નથી એ જૂઠું બોલે છે એમણે પત્ર લખ્યો હશે તે તેની ઓફીસમાં કોપી રાખી હશે! તો તેની નકલ કરીને મોકલો વિગેરે મતલબનો લખ્યો તેનો જવાબ તા. ૧૬–૯–૨૦નો નીચે પ્રમાણે આવ્યો. શ્રીમાન પુજ્ય સૈયદ બાવા સાહેબ અહમદ-અલી જોગ મુ. પીરાણા, વિંનતી કે આપનો પ્રેમથી ભરેલો પત્ર મને મલ્યો વાંચી મલવા સમાન સંતોષ એ કે કોઈ નથી, પણ દિલમાં આનંદ થયો છે, બાદ તમે લખો છો તે લોકો ખોટા બાના બતાવે છે. તો હવેથી મને પણ તેઓના ઉપર શક આવે છે કે ખરેખર તેઓ સત્યવકતા છે નહિ કારણ કે જો તેઓએ પત્ર લખ્યો હોય તો તે નકલ જરૂરથી રાખે? પણ મીત્ર મંડલના સેક્રેટરી ને પ્રમુખ

realpatidar.com

https://archive.org/details/bk076/page/n25/mode/1up

realpatidar.com

અમદાવાદ આવેલ છે. તેથી મેં તેના જોઈંટ સેક્રેટરીને જરા મીત્રભાવથી પુછી જોયું તો તેણે ઘણી તપાસ કરી પણ બીજી નકલો પડેલી છે તેમાં તે નકલ બાલકુલ મલી જ નહિ પછે તો ઇશ્વર જાણે કે કઈ વાત સત્ય છે. બાકી તે લોકોની દર શનીવારે તેની લાયબ્રેરીમાં મીટીંગ ભરાય છે. તો તે મુજબ કયા રોજે ભરાણી હતી તેમાં તેને અમદાવાદનો પત્ર સેક્રેટરીના હાથનો લખેલ હતો. તેમાં લખ્યું છે, કે રીપોર્ટ ઘણો સારો થશે ભાષણ ઉત્તમ શૈલીથી લખાણા છે. એ વિગેરે મતલબ હતી. ×+×++ લી. રત્ના સીવજી" પછી "તા. ૮-૮-૨૦ની પરીષદનો રીપોર્ટ તા. ૧૫-૧૦-૨૦ સે બુક પોસ્ટથી આવ્યો. તેનો જવાબ તા. ૧૮-૧૨-૨૦ લખ્યો. તા. ૧૩-૧૧-૨૧ છપાવેલ પત્ર આવ્યો. તેનો જવાબ તા. ૧૮-૧૨-૨૧ ને રોજ મોકલ્યો. તે વિના સત્પંથ ઉપર આક્ષેપો કરનારને સુચના મગનલાલની કપાલીનો જવાબ, આદિ ઘણા લેખો લખ્યા છપાયા છે. જે પત્રો હમને મલ્યા તેની સુચનાઓ તુર્ત લખી તેમજ સત્પથ સંબંધી ટુંક નિવેદન નામની બુક, સત્પંથના મંડન માટે જ વેદોનાં પ્રમાણ સહ છપાવી છે. **કલિતારક સંક્રમ** 'ભાભારામ સુબોધાદિ' ઘણા પુસ્તકો સત્પંથ વિશે વેદાદિ શાસ્ત્રના મુળ મંત્રો, પ્રમાણો માટે છપાવેલા છે, તે સર્વ નારણજીએ વાંચ્યા છે, છતાં જવાબ કોઈએ દીધો નથી, છતાં આમ લખે છે, આનુ નામ તે તોપ !!! સબુર ! ખરેખર એ જવાબો નહિ. પણ સુચનાઓ

realpatidar.com

https://archive.org/details/bk076/page/n26/mode/1up

realpatidar.com

હતી જવાબ સત્યપંથી થયે દેવાશે! કુંપનીસહ તમારી કોસોટાઇ અંકાઇ ગઇ! હવે ગમે તેટલા ઇર્ષાએ અંજાઈ, ખોટી બડાઇના બણુગા કુંકયા કરો! આ અને બીજા સર્વે પત્રો વિગતવાર જવાબમાં જોશો.

કલહ પીપાશુઓ બીજાને પ્રેમ પંથે કેમ લાવી શકે? તમે તમારે ગાળો ભાંડયા જ કરો! તમારે બ્હાના કાઢી ગાળો ભાંડવી હોય તેટલી ભાંડી લેજો! પણ શ્રી નિષ્કલંકી નાથની નિંદા ત્યાગી સાફ જ્ઞાની થાજો. તમારા બોલે બોલની ચુક્તિ ઉઘાડી પડેલી જોઈ ભેજું ખોઈ બેઠા! ગાળોનો વર્ષાદ વર્ષાવી જાત દેખાડી, કડવાજી! આસ્થાવીણુ માણસને હજારો શાસ્ત્રો મિથ્યા છે, શાક્ષાત પ્રભુને પણ શત્રુ માને. આપ જેવાને સમજાવવા આટલી મિથ્યા મેહનત ન કરૂં? આ સજ્જનો માટે જ મારો પ્રયાશ છે. તેઓ ન્યાય કીમત કરશે.

ગંગામાં શહેરની ગંદી ગટર અને મડદાના અસ્થી અસંખ્ય ખાંડી નિત્ય વહ્યાજ કરે છે. છતાં તે પવિત્ર રહીને જે સ્વચ્છ રક્ષાએલા ગંગવો કુવો કે જેનાં પાણીએ દિવા બળ્યાં છે, તે ગંધાતી ગટર બને! ઇર્ષા એ જ મૂર્ખાઈની માતા છે.

ગંગાજી જગન્નાથ પણ્ડિતાદિનાં ચમત્કારો ખોટા કહી તેની નિંદા કરે! કાંઇ તેથી તેનું પાણી ખારૂં નહિ થાય? તેમને કયાં ભાન છે? 'ગંગાજી તો કયારનાએ સ્થળાંતર કરી ગુજરાતમાં પધારી સાબરમતી થઇ ગયા.

realpatidar.com

https://archive.org/details/bk076/page/n27/mode/1up

realpatidar.com

ગંગાના ચમત્કાર શાસ્ત્રે કહેલા, નહિ માનો ? તો લો આ જાહેર પેપરોએ કહેલા માનસો ? 'તા. ૨-૭-૨૫ના પેપરમાં કટકમાં પુરૂષ હતો, તે ઘણે વર્ષે સ્ત્રી થઈ ગયો તા. ૧૦-૫-૨૫ નળી નગરાના શિવાલયનો ઉદ્ધાર કરનાર એક અંગ્રેજ ગૌમૂત્રથી સ્નાન કરી પિતાંબર પહેરી શિવ પૂજન કર્યું, બ્રાહ્મણો મોઢા ફાડી જોઇ રહ્યા !' તા. ૧૬-૮-૨૫ જેની મેગણીમાં એક સ્ત્રીએ હાથીને જન્મ આપ્યો ? તા. ૨૫-૮-૨૫ સે નાગપુરમાં તાજુદ્દીન ફકીર મરી ગયા, તેમનાં વિયોગથી પાંડુરંગના દેવળમાં વિઠ્ઠલ અને રૂક્ષ્મણીની પથ્થરની મૂર્તિઓ ૨૪ કલાક રોઈ ને આંખો-માંથી આંસુઓની અખંડ ધારા વહ્યા કરી તા.૧૦-૮-૨૫ ના રોજ લખતરમા મહાદેવના મંદિરમાં જ્યોતિ પ્રગટ થઈ કોડીયું ને દિવટ કોરા હતા. અશલાલી ગામે સને ૧૯૨૫ના અગસ્ટ માસમાં એક પાટીદારણને ત્રણ બાળકો એકી સાથે જનમ્યા, તેમાં ૧ તુરતથી બોલતો ને વાતો કરતો હતો, સવા માસ થઈ ગયો હજી જીવે છે. એવા અસંખ્ય પરછા જવાબમાં જોશો... ધર્મ રહસ્યનું ગૌતમ બ્રાહ્મઋષિ જેવા પણ જ્ઞાન શિખવા પંચાળ રાજા પાસે ગયા હતા. "છંદોગ્ય પ્ર. ખ. ૩ મ. ૬-૭-૨"

હમારી બુકોની પ્રસ્તાવનાઓમાં અવારનવાર યોગ્ય સુચનાઓ અપાય છે. તે ધર્મ નહિ સાચવી શકનારાઓની ટીકા માટે હોય ! ધર્મ પાળનારા ધર્મિ કહેવાય તેઓ માટે તો કાંઈ પણ લખવાનું હોય જ નહિ તમારે એનું

realpatidar.com

https://archive.org/details/bk076/page/n28/mode/1up

realpatidar.com

નહિ તો તેનું, નામ ગોઠવી ઉશ્કેરણી કરાવી વઢાડવા છે ! વ્યક્તિગત ટીકા કરવાની મારી ધારણા જ નથી. કોઈ પણ ધર્મિની લાગણી દુઃખાએ તેવો મારો લેખ હોય જ નહિ. રૂઢી કોઈને કાંઈ આંતરાય આવતું હોય ને તેઓ ભલામણ કરે, પણ તેથી જો ધર્મને બાધ ન આવતું હોય તો તે સુધારવામાં કાંઈ પાપ હું તો જોતો નથી. આજ ધમકીઓ, બીહીવરામણી ન્યાયી બ્રિટીશ સલતનતમાં કોની ચાલે તેમ છે ! કલ્પોથી સત્ય ધર્મનાં પ્રચારકોએ પ્રચાર કર્યા જ કર્યો છે. અશુરો ત્રાસ વર્તાવેજ ગયા છે ? વિદ્વાન રાવણ બ્રાહ્મણ કાંઈ થોડો હઠીલો નહોતો ! તેણે પણ ઘણા વિદ્વાન બ્રાહ્મણોનું ટોળું શ્રી રામની શત્રુવટમાં તમારી પેઠે ભેળું કરી લીધું હતું. વાંદરા, ભીલ, ભાવડા જેવા અભણ પણ આસ્થાવાન શ્રી રામ શરણે રહી બ્રાહ્મણ બની ગયા. શ્રી રામે જેમ ભોળી કોમ વાંદરા ભીલ, ભાવડાંને ઠગ્યા ! શ્રી કૃષ્ણે ગોવાળ, ભરવાડાદિ જેવી જંગલી કોમને ઠગી ! એ તો એના ઘરનો ધારો છે. તમારી પેઠે રાવણ, કંસ, દુર્યોધનાદિ નાછેતરાયા ! એ તમારા ઘરની કુશળતા છે ! વિદ્વાનોની વિદ્યા અહીં જ જોવાની છે.

તમારા જાહેર ચેલેંજો માટે સત્પંથિયો ઘણી વેળા કચ્છાદિમાં મળ્યા, તમો સન્મુખ બેશી વાત કયાં કરો છો ? તેઓ આવે દેશમાં તો તમો બીજે જાવ ! સંવત ૧૯૭૨ માં ભથાણના મેળાવડામાં ભાગ લેવા હમને ભાગ્ય પ્રાપ્ત થયું હતું. બહાર ગામથી વિદ્વાનો નહોતા આવ્યા ત્યાં સુધી તમારી કંપની રહી, જ્યાં વિદ્વાનોને જોયા કે એકડ બેકડ

realpatidar.com

https://archive.org/details/bk076/page/n29/mode/1up

realpatidar.com

પલાયન કરી ગઈ! સમય વિચારી પુંઠ પાછળ ગપ્પા ઉડાડે વડાઈ શેની? આવી કુથણીએ સત્પંથનો રહસ્ય નહિ મેળવી શકો. શિષ્ય ભાવે સંકાનું સમાધાન કરી શકશો. માટે સત્પંથની રૂઢીએ નમૃતાએ માફક આહાર તજી સત્પંથીની પાસે યાચો.

કંસ, રાવણાદિ શ્રીજીના અવતારોની લીલાને તમારી પેઠે નિંદતા હતા, તેથી કાંઈ શ્રીજીની હલકાઈ ન થતાં દહાડે દિવસે ચડતી કળાએ યશોગાન ગવાતાજ રહ્યા! હજુએ જગત પ્રેમથી સંભારે છે. રાવણાદિના નામોને તો તેની દુષ્ટતા પ્રતાપે ધુત્તકારે છે.

કરાંચીના તમારા કાર્યાલયનો ભંડાર તપાસજો, હમારા પત્રો શોધી વાંચી મોઢે હાથ ફેરવી સાચું લખો! જુઠ ત્યારે જ જણાંઈ રહેશે. ખુણે બેશી રોવાનું ત્યારે જ શૂઝશે નાણા માટે ધર્મ નથી. હજારોના ઇનામ તમારા તમને ગંધાય! રાવણસાઈ ધનનો ધર્મ નથી, સત્પંથી ધન માટે ધર્મ અનધિકારીઓને નહિ સોંપે.

× સત્પંથ વેદાનુકુળ ધર્મ છે. કબ્રસ્તાની કે કોઇ પણ પક્ષપાતી ટોળા બાજ વઢવાડિયો, કુસંપી ધર્મ નથી. તેને ચઢતી પડતી નથી, તેને કોઇની કળા કે ચુકિત પુણતી નથી. સમયાનુસાર શ્રીજી પોતાની લિલા કર્યાજ કરે છે તેનો હર્ષ કે. શોક ન હોય, હર્ષ શોકમાં એટલું કે 'ધર્મની પડતીમાં શ્રી નિષ્કલંકી નાથ પધારે, દર્શનની અભિલાષા થાય છે, તેમ ચડતીમાં હજારો સજ્જનો

realpatidar.com

https://archive.org/details/bk076/page/n30/mode/1up

realpatidar.com

મોક્ષાધિકારી થાએ છે એજ. શ્રી નીષ્કલંકીનાથના શતરૂઓ ભલે બળાપો કરી બળી મરે !

[પ્રસ્તાવનામાં જે પ્રાસંગિક નોંધ તો સત્ય વાતમાં ગર્ફલીત ન થાય, અવળા રસ્તાની દોરવણી પખાંઈ જાએ તે પૃતિ હોય ! પીરાણાના સ્થાનોમાં ઘોડા દોડના અખાડા, રેશ રમિવાના કારખાના, હજારો માણસોના ઘોડા આદિના તબેલા, રેશ રમનાર ગ્રહસ્થોના બંગલા, જાહેર પેપરોનાં રીપોર્ટરો સ્થાનાદિ કયા ખોણામાં સંતાડી રાખ્યા છે ? આવો ! બતાવો ! રેશની શર્તોના રીપોર્ટો બધા પીરાણાનાં સ્થદાનનાજ પેપરો પ્રગટ થાય છે ? કડવાજી વિચારીને તો બોલો ! પોકળ પાધરૂં થાય ત્યાં સુધી ભાન નથી રહેતું ? તમોને વર્ણ સંકર પણાના સમ છે, જરૂર રેશની હાર જીતમાંથી કોઇપણ કાકા કે સૈયદનું નામ કાઢી બતાવો ? નાણાવટાની શ્રાફની પેઢીયો તમારા મહાત્માઓનીજ જૂઓ. બેંકો ચલાવતાં નાણા વધેલા ના૦ સરકાર ને સાચવવા પડે છે. તેમ પીરાણાનું એકે બતાવો ? અનાદિકાળની પ્રથા છે કે ધર્મ વ્યવસ્થાને જાગીર વ્યંવસ્થાનોખી નોખીજ રહ્યા કરતી. જ્યાં સુધી ધર્મ સંસ્થાનોમાં એ નિયમ જળવાયો છે ત્યાં સુધી ધર્મમાં બગાડો થયો ન હોતો, જ્યારે ધર્મ વ્યવસ્થાને જાગીરની વ્યવસ્થા એક માણુસના હાથમાં હોય છે ત્યારે જ ધર્મને ધોકો લાગે છે. તેમ જાગીરી વ્યવસ્થા પણ યોગ્ય થતી નથી. બે ગતા જીવથી એકે કાર્ય સિદ્ધ નજ થઈ શકે ! તેથી તેવા સંચાલકોનું બેરૂપી જેવું

realpatidar.com

https://archive.org/details/bk076/page/n31/mode/1up

realpatidar.com

સ્વરૂપ દેખાવવાથી લોકોને આક્ષેપ કરવાનો સમય મળે હાલ દરેક ધર્મ સંસ્થામાં જોતા હશો ? કે ત્યાગી કહેવડાવનારા નાણાની વ્યવસ્થા કર્તા હોવાથી કેવી કેવી વિટંબણામાં પડી ધર્મ ખોઈ ફોજદારી કોર્ટોમાં કુતરા સમ રઝળ્યા કર્યા છે ? બતાવો કડવાજી ! એ કયા મહાત્માઓનો વિષય છે કલેહ પ્રિય કડવાજી ! ખરી વાતો ઉલટાવી સત્પંથની શતરૂવટમાં આંધળી ધાંધલ બહુ ના ચલાવો ! કાંઈ હાથ પગ ભાગશો જૂઠું સાંધી વઢાડી મારવાની વાત ન કરો ! ઘણા ડોળ ઘાળું, છત વિનના પૂજ્ય થવા મથનારાના રાફડા ફુટી નીકલી, ગામો ગામ મઠો બાંધી ત્રાસ વર્તાવી રહ્યા છે. કોટડામાં કાલીદાસે, ગુતરી, ગઢનાં સાધુજીએ કાંઈ ઓછો કહેર વર્તાવ્યો નથી ! વીરાણી મેઘવાળ સાધુએથી વટલવાની બુમ પડી, નેતિયારાદિના પૂજાવવાનું તાજુ તરમ છે. ડાકોર, મુંબાઈ આદિની નોંધાયલી ફરિયાદો જૂઓ ! ભવયાને તમારા ગુરૂપણાનાં મોહે કયાં ઓછા ફટાવ્યા છે ? એ જાણ્યા છતાં ઉશ્કેરણીની ધાંધલ યોગ્ય નહિ કહેવાય ! ભલે તમે એવાની દલાલીમાં આબરૂ માનો !

સત્પંથ બાહેર ભીતર સરખો છે, દગાબાજ દલાલોના હેતુનો ઉઘાડ છે, પુસ્તકો સત્પંથી વિના અન્ય ઘણા ગ્રહસ્થો લઈ ગયા છે. તમારૂં જ ચિત્ત ચકડોલે ચડેલ હોવાથી સર્વને ફરતું જુઓ છો. તમારા કુથણીના ભરેલા ચીથરિયા લેખો મારા હાથમાં આવ્યા નહોતા, ત્યાં સુધી તમારી પ્રતિક્ષાની ઉત્તકંઠા હતી. તે તમારા ચીથરિયે

realpatidar.com

https://archive.org/details/bk076/page/n32/mode/1up

1980 - Narayan Ramjino Pratidhwani (76)

realpatidar.com

મુંછી નાખી! 'સત્પંથની સમજ' નામની બુક તૈયાર છે; પધારો વાંચી જાવ, વધઘટ હશે તો શ્રી નિષ્કલંકીનાથની કૃપાએ પૂર્ણ થઈ જશે. તે છપાવવાનું નાણાંનાં દોષે અટક્યું નથી, મારી શક્તિનો સવાલ એક તરફ છે, 'સાચો જુઠો ન કરવો વાદ.' એ સવાલે અટકાવ્યું છે, મદદને નામે સલાહની માગણી છે, રૂપીયાની નથી. હમારા સર્વ લેખો પ્રતિધ્વની કે સમાલોચના રૂપે છે, સર્વ સત્પંથી સંઘ મલી ધર્મ સમજાવવા સભા કરે, તેમાં તમારે માહેતી મેળવી જ લેવી. આમ નકામાં ત્રાસ વર્તાવી ફાંફાં મારે કાંઈ નહિ વળે, તમોરી માંગણીનાં જ લીધે હિંસાવાદની દલીલો આપી છે સત્પંથ તેવું લખવા પણ મના કરે છે.

વેદોની કહેલ દશાંસ ના નામે ભડકનાર કડવાજી! વેદાદિ શાસ્ત્રો ઉપર દયા લાવો, કલિયુગમાં દશાંશ નોજ મહાતમ્ય છે. પારાસર સહિતા અ૦ ૧, શ્લો. ૨૨ અ૦ ૨ શ્લો. ૧૩, ૧૪, ૧૫; ઋગ્વેદ મ, ૧ સુ. ૧૨૪ મં. ૧૦ ઋ૦ વે૦ મં. ૧ સુ૦ ૧૨૫ મં. ૧ ઋ. વે. મં. ૧ ૨૨, ૧૨૫ મં. ૩ આદિ ઘણા પ્રમાણો છે. (જવાબમાં જોશો)

'સવાલાખ વર્ષનું રાજ, હજારો દેવ કન્યાઓ સાથે ભોગવવાનું વેદ શાસ્ત્રોમાં છે. જુઓ, પા૦ સ૦ અ૦ ૨ શ્લો. ૪૪, ૪૫, 'બ્ર૦ ગી૦ અ૦ ૧ માં સુખની સીમા બાર લોક વારી, એકથી એક સો ઘણી વધારે લખેલ છે. ઋગ્વેદ, અથર્વવેદાદિની આજ્ઞાએ પુષ્કળ છે. સત્પંથીઓ

realpatidar.com

https://archive.org/details/bk076/page/n33/mode/1up

realpatidar.com

સ્વર્ગ સપ્રેમે વધાવી લે છે, તમો ભલે તેથી વિપ્રીત માની નર્ક કબુલો! વહેલા સ્વર્ગમાં જવું હોય તો પહેલા આવી! જોઈ જશો કે વેદાદિ શાસ્ત્રોમાં કેવા વાયદા હુડિયામણોના, ને રાજ્ય વૈભવાદિના કરેલા છે? શ્રી સદ્ગોર પીર ઈમામશાહે તો તેમનો સોમો ભાગ પણ જાહેર કર્યો નથી. કડવાજી! મીઠા થાવ! વેદાજ્ઞા માનવાનો અભ્યાસ કરો! (ઘણા પ્રમાણો જવાબમાં જોશો.)

સત્પંથીયોને રૂચે છે તો સેંકડો રૂપીયાનો ફંડ ઘડીક વારમાં ભેળા કરી દે છે. નરૂચવાનું એ ચિન્હ છે કે ફંડ ન થાય! જેમાં સત્પંથી સહમત ન હોય તે વિરૂદ્ધ મારે કાંઈ કરવાની જરૂર ન હોય. પીરાણાની જગ્યાનો કેશ કોર્ટે લઈ જનારાઓમાં હમારૂં નામ ગણતાં ભુલ કરી છે. તે ઝઘડા સમે હમે હમારી બેનના કામમાં રોકાયેલા હતા. હમને તેમાં શું થતું? તેની પણ ખબર નહોતી. લેખ કયાંનો? ને લડાઈની વાત કયાંની? ધન્ય છે તમારી ધર્મ બુદ્ધિને!!!

તમારે ખર્ચે છપાવવાની હોંસ છે તો સમય આવે લેખ છપાવરાવવા આપીશું. રખે વચન ભંગ થતા?.

હમે જેવી રીતે સત્પંથ ધર્મ માન્યો છે, તેજ પદ્ધતિએ હમારો વ્યવહાર જળવાઈ રહે તે માટે શ્રી સદગોરને નિત્ય પ્રાર્થિએ છીએ. જગ ન્યાય છે કે ક્યાંજે મત, તે ધર્મ નથી. વેદ કહે તે ધર્મ છે. મ. સ. સ૦ અ૦ ૨ શ્લોક ૧ રાગાદિવિનાના અને વેદોનું રહસ્ય

realpatidar.com

https://archive.org/details/bk076/page/n34/mode/1up

realpatidar.com

જાણવા વાળા સજ્જન પુરૂષોએ સંસય રહીત હ્રુદયથી જાણેલોને આચારવામાં મુકેલો તેજ ધર્મ કહેવાય.' વેદોકત લેખના ફકરા તમારી દલીલોને ઉંધી મારનાર હોવાથી તેને ઉથલાવવા યુક્તિયો કરશો નહિ. બુદ્ધિમાનો ન્યાય કરશે, તમારા તમને જીપુજ' કહે ! મારા મનથી ગોઠવી કાંઈ લખવાની જરૂર નથી. વેદાદિ શાસ્ત્રો પ્રમાણે જ લખ્યું છે. 'મનુભગવાન ધર્મે ચાલે તેને પુણ્યશાળી કહે છે, તમે ધર્મ દ્રોહીને પુણ્ય શાળી કહો ! કહો, કહો. કડવાજી !

સત્પંથને વેદે શીખડાવ્યું છે કે 'ધર્મનું મુળ. વર્તમાન કાળમાં વર્તતુ પરમાત્માનું સોળ કળા વાળું સ્થુલ. શરીર તેને ખોળી ઓળખી તે આધિન થવું તે છે. તેથી ઉત્તમ બીજુ કાંઈ પણ નથી. ભલે તમો તેના શતરૂ પણાને ઉત્તમ માનો, હમારે શું ! શ્રુતિના અર્થ શાયણા ચાર્યનાં ભાષ્યા ધારે લેખોમાં લીધાં છે. કોઈક ઠેકાણે અન્ય આચાર્ય શ્રીના ભાષ્યનો પણ આધાર હશે. છતાં તમારે તેના ખરા અર્થ પબ્લીકમાં મુકયા પછી ખોટા કહેવા બહાર પડવુ હતું !

પવિત્રોનાં પાર્ષોશમાં કુટિલ સાધુઓ ભરાયાથી કેવો અત્યાર વર્તે છે ! ભેખને બાને ભૂલા પડેલા કેવા કુટાય છે ! શ્રદ્ધાળુઓને કુટીલો ઠગી કેવો સત્યાનાશ વાળે છે ! તે લક્ષણો પ્રગટ કરી જાગ્રત કર્યા છે. કચ્છમાં જુગાર નથી ! તો પોલીસ કોર્ટો તપાંસો કે કેટલાક જુગારિયો

realpatidar.com

Most of the information is mentioned with the intention of discrediting the Great Shri Narayan Ramji Limbani & his team and to demean the good work done by them in uplifting ther fellow caste members.
Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk076/page/n35/mode/1up

realpatidar.com

ડંડાયા છે, આખી દુનિયાની આંખો આગળ ધુળ ના ઉડાડો. આવો લૂલો બચાવ જગત કબુલ નહિં કરે! ભેળા રહેનાર ભાઈઓ ઘણી વેળા વઢી શતરૂ પણું ભજવે છે. ઘણી વેળા મિત્ર બની સંપમાં રહે છે, તેમાં તમારા કુટણુપા કામ નહિ આવે ને તેમાંથી તમોને કાંઈ પ્રસાદી મળે તેમ નથી. હમારૂં રક્ષણ શ્રી નિષ્કલંકીનાથ ને હસ્તે છે, તમારી ધમકિયોનો પ્રભાવ ડુબી ગયો. નાણાની ચેલછાડ માયાવિયોને હોય છે, ધર્મનો મર્મ ધર્મિયોજ જાણે છે, ધર્મ નહિ સમજનારા પૈસાની લાલચે પરહસ્થે વેચાય છે. સત્પંથી કદીએ સત્પંથને શત્રુ માનનારની મદદે પૈસા જેવી નજીવી વસ્તુ માટે નહિ જાય? શત્રુ શત્રુની, મિત્ર મિત્રની મદદ કરે છે. યાદ રાખજો જે સત્પંથના શત્રુના શરણે પૈસા જેવી નજીવી વસ્તુની લાલચે આવે છે. તે સત્પંથનો ભેદ રંજ માત્ર પણ જાણતો નહિજ હોય! પછી તે તમને ઠગે, કે તમો તેને ઠગો, બન્ને સરખા રહેશો.

તમારી જ્ઞાતિના અંગત વહેરે ધર્મના શત્રુ બનિ જ્ઞાતિ તોડી પાયમલ કરવા સ્વછંદીપણું આદર્યું છે. તેથીજ જ્ઞાતિ તમને ધિક્કારે છે. ધર્મની નિંદા કરે શું વળશે! ખાર, ઝેર, દ્વેષના સાધકોને વિજયમાળ નહિ, પણ ખલ્લાની માળ મળે છે, વિજયમાળા લેનાર ઉદાર, દયાળુ, સમાન ભાવવાળા પ્રમાથી હરિચંદ્રાદિ ભક્તોના ચરિત્રો વાંચો.

realpatidar.com

https://archive.org/details/bk076/page/n36/mode/1up

realpatidar.com

દ્રવ્યે ધર્મ કોણ વેચે ? શ્રી રામચંદ્રાદિ વિરૂદ્ધ ઉશ્કેરતા રાવણાદિઓએ પુષ્કળ ધનનો વ્યય કર્યો હતો. બ્રાહ્મણો શુદ્ધાં શ્રીજીના વિરોધી બની ગયા હતા. તેમ તમો રૂા. ૧૦૦૦૦) ની બૂમ જગતને ઉશ્કેરણી કરી ને ઠગવા યુક્તિ રચી છે. તમારી સ્થિતિ તેટલા રૂપીઆ આપી શકો તેવી ક્યાં છે ? તમને રૂપીયાનો મોહ છે, રૂપીયાના સાટામાં ધર્મ માંગો છો ? લાખો રૂપિયા ખરચતાં ધર્મ નહિ મેળવી શકો, ધર્મ દિનતામાં છે. દ્રવ્ય પીપાશું લાલચનો માર્યો 'જડ' તમારા સપાટામાં આવ્યો હોય ! તેટલા ઉપર સંતોષ માનો.

કચ્છમા વસતા સત્પંથી પાટીદારોનું 'કુળ' રાજ્યના જુના, નવા દફતરે લેઉવા પાટીદાર લખાયું છે. વસ્તી પત્રકોમાં પણ લેઉવા પાટીદાર, જ્ઞાતિ દફતરે, લેઉવા, પાટીદાર, ધર્મ દફતરે પણ લેઉવા પાટીદાર લખાયેલ છે. તમારી દ્વેષાગ્નિ જ્ઞાતિ તોડી છીન્ન ભીન્ન કરવા 'કડવો' પણું કરાવે છે. કચડવા જ્ઞાતિ મહાન દરિયા સમાન છે, તેમાં ઘણાં સજ્જનો ચતુર ને સુજ્ઞ પુરૂષો પ્રખ્યાત છે. તેઓને છેતરવાના દંભે કરી તેમાં પેસી જવા માર્ગ કર્યો છે ! જ્યારે એકલા આખી જ્ઞાતિને ન પહોંચી વળ્યા ? ત્યારે એક નવી યુક્તિ અજમાવી છે. કચડવા મહાશયો તમારા એકના છેતર્યા ! છેતરાશે નહિ, આખી જ્ઞાતિ જ્યારે પોતાને લેઉવા કહે છે ! તો તે તમારૂં આવું તુત કબુલ નહિ કરે. છેતરાયા હશે તો તે જરૂર ત્યાગી દેશે. તમે તમારી

realpatidar.com

Most of the information is mentioned with the intention of discrediting the Great Shri Narayan Ramji Limbani & his team and to demean the good work done by them in uplifting ther fellow caste members.
Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk076/page/n37/mode/1up

1980 - Narayan Ramjino Pratidhwani (76)

realpatidar.com

મૂળ જ્ઞાતિને તોડવા તે ઉપર અસહ્ય જુલ્મો વર્ષાવી રહ્યા છો ! દરેક રીતે પાયમાલ કરવા મથ્યા કરો છો, છેવટે તમારેજ પયમાલ થવું પડયું છે, હવે પણ જે જ્ઞાતિમાં જાઓ છો ત્યાં સખના રહેજો ! રખે રૂપ પ્રકાશી ધાંધલ મચાવતા હમો અખીલ 'કચડવા' જ્ઞાતિને ખાસ ભલામણ કરીએ છીએ કે નારણભાઈથી હુંશિયાર રહેજો યુકિતબાજ ને વિચિત્ર માણસ છે, તેને ફરતાં વાર નહિ લાગે, તે સત્પંથી આલમ સાથે નાહક તમને વઢવાડમાં ઉતરાવશે તમારામાં ભળવાનું એજ કારણ છે.

ગુરૂ મહાતમ્યનું ભાન સુગરાઓને હોય છે, ગુરૂ ગીતા વાંચો પછી નુરગોળીની ઈર્ષા કરો ! એ તો ખાસ અમૃત છે. કયા દ્રવ્યને લઈ તેને મલીન કહો છો ? કૃષ્ણ જન્મ સમયની ચર્કીનની પ્રશાદી મેળવી ભાગ્યશાળી થયા છો ! કે નહિ ? કડવાજી ! બોલો, બોલો, કે તેથી પણ અભાગિયા રહ્યા છો ?

ઘટપાટ (કુંભ) પૂજા વિષે શ્રી શંકરે પાર્વતીજીને કહેલી કથા સુત સન્કાદિકે કેવી છટાથી વરણવી છે ? તેમાં કઈ કુટીલ ક્રિયા છે. તે પ્રગટ કરો ! એજ વિધાનમાં લાજ મર્યાદા, વર્ણાશ્રમાદિ સર્વ વિવેકો જળવાઈ રહ્યા છે. તે પુજાની ક્રિયામાં ભાગ લેવા તમો નહિ, તો તમારી માતા, માસી, નાની, ફઈ, દાદી, પરદાદી કાકી, મામી, બેનો, ભાણેજો, કટમણો બાપા, આદિ ઘણાએ જીવન પ્રર્યંત અસંખ્ય વેળા ભાગ લીધો છે, તેમને પૂછી જુઓ !

realpatidar.com

https://archive.org/details/bk076/page/n38/mode/1up

realpatidar.com

કે તેઓએ પૂજામાં કેટલી? ને કઈ કઈ વેળા? કેવા પ્રકારે કુટીલ, નિર્લજ, નફટાઈની ક્રિયાના કાર્યો કર્યા છે! ને કેવી રીતે? તેમાં તેઓએ ભાગ લીધો છે? પૂછો કડવાજી! પુરાવા પાસે પડયા છે છતાં બાહેર શેની શોધ કરો છો? નફટાઇના કાર્ય જોવા હોય તો ઋગ્વેદમાં અશ્વમેધ પ્રકરણ જુઓ, યજમાની અને અશ્વનો યોગ કેવી વિધિથી યજમાની શું, શું કરતી ને કહેતી ફરે છે! તે વિગતવાર લખેલ છે, તમારો એકલાનેજ વાંચવાનું હોત જરૂર વિગતવાર લખતે, પણ કોણ જાણ કેવા સજ્જનો ને સન્નારીયોના હાથમાં આ લેખ જશે? માટે લખતા અચકાઉં છું. બોલ-બોલ જૂઠ બોલતાં કડવાજી લજ્જા પણ ના આવી!" પગ નીચે તાપણી બળે ને બીજાની નિંદા!!!"

સત્પંથ ઈશ્વરી વાણીમાં મનાવેલ સર્વ દેવ દેવીને મનાવે છે, તે દ્વેષિયોને ન સુજે! આપ્ત પુરૂષ માટે ન્યાય દર્શન જુઓ! ऋष्यार्य म्लेच्छानी समानं लक्षणाम" આમ માનવામાં ઋષિ, આર્ય, મલેચ્છ એ ત્રણેનાં લક્ષણ સમાન સરખાં છે, આપ્તનાં લક્ષણ વાળો ગમે તે જાતીનો હોય પણ આપ્ત પુરૂષ (પુજ્ય) ગણાય છે? પારા સર સહિતાદી એજ બતાવે છે. લક્ષણ વિનાના પુજ્ય નહિ (વિશેષ જવાબમાં જોશો)

realpatidar.com

તમારી જીભ તમારા મોઢમાં રહે. તમારૂં રાંધેલ તમને પીરસતાં પીરસનારની જીભ જાય? એ કેવો ન્યાય!

https://archive.org/details/bk076/page/n39/mode/1up

realpatidar.com

પ્રથમની પેઠે તમારૂં રાજ્ય હોત તો જરૂર શ્રી નિષ્કલંકી નાથને આવવું પડતેજ, કડવાજી તમારી સ્થિતિ, ન ઘરનાં કે ન ઘાટનાં, ના જેવી થઈ ગઈ, અર્ધ દગ્ધ હાલતમાં ફસાઈ ધર્મ ખોઇ નીચ વર્તિએ બંધાઈ ગઈ છે. હિન્દ દેવીનાં પુત્ર થવાની લાયકાતે ખોઈ બેઠા છો ! જ્ઞાતિમાં આગેવાનો વિરૂદ્ધ ઘણા કુકર્મો કર્યા કરો છો, છતાં તેઓ તમારા કલ્યાણ માટે દુઃખ સહન કરી સલાહ સંપ જાળવવા તન તોડ મહેનત કરી રહ્યા છે. તેઓ તમો તેઓની ઘણી ઘણી નિંદા કરો છો, છતાં તેઓ ઉદાર વૃત્તિએ તમારૂં કલ્યાણ જ ઇચ્છી રહ્યા છે. તમને જ્ઞાતિ પાયમાલ કરવા ધારે તો એક ક્ષણમાં હતા નહોતા થઇ જાવ, પણ મોટાના મન પણ મોટા હોય છે. તેઓ દયા ક્ષમા આદિને લઈ ઘરઢેરા બન્યા છે. તેઓ શુદ્ધ સનાતની છે, હોટલુંનો ખોરાક, માદક પદાર્થોના સેવન, કુસંગતે તમોને અર્ધદગ્ધ બનાવેલા છે. નહિ તો સ્વજ્ઞાતિને મેલી બીજી જ્ઞાતિમાં નજ જાતે ! આમ કુળને કલંક ન લગાડતા ! જ્ઞાતિને ગાળો ભાંડી કુળને કલંક લગાડયું છે. કુળને કંલક લગાડનારો કપુતજ હોય.

સુદાંને દાટવાનું વેદમાં હોવાથી સત્પંથી દાટે છે ઋગ્વેદાં ૧-૧૮-૧૧ હે ભૂમી ! તારો હાથ ઉંચો કરી મૃદાને લે !" ઋગ્વેદ ૭-૮૯-૧ ઓ વરૂણ મને એટલી વારમાં માટીના ઘરમાં લઈજવા નાં દઈશ ઋગ્વેદ ૬-૨૮-૧૦ તથા અ૦ ૨-૨૧-૧૮ " પૃથ્વી મૃદાંને શાચવી

realpatidar.com

https://archive.org/details/bk076/page/n40/mode/1up

realpatidar.com

રાખજે. આદી મતલબ છે (એ વિનાં ઘણા પ્રમાણો જવાબમાં) તેમ પ્રતક્ષ રીતે નિયમ પ્રમાણે દાટેથી ઘણો લાભ છે. દુર્ગંધ ન આવે, ચેપી રોગ ન ફેલાય. સ્ત્રી પુરૂષોની મર્યાદા જળવાય; અગ્નિમાં અનેક જીવની હત્યા થતી અટકે, બાળવાથી એથી વિપ્રીત બંધુએ થાય છે તેમાં કોઈ મડદું બળતાં અર્ધંગ્ધ સ્થિતિમાં ઉભું થઇ જાય છે તે વેળા વાંસના ગોદા મારી મારી ભુંડા હાલે પાછો પાડવામાં આવે છે, એ કરૂણા જનક દેખાવ કોઇથી પણ જોઈ ન શકાય તેવો છે; બાળવું એતો મરદાની કફોડી સ્થિતિ કરવા સમાન છે. રોગી મુર્દાનો ધુંવાડો ડાઘુઓ અને આજુબાજુમાં રોગ ફેલાવી ઘાણ કાઢી નાખે છે. આદિ ઘણી વિપતીઓ નડે છે, છતાં તમારે બળવું હોય તો બળો, પણ અન્યને ભેળાં સા માટે બાળો છો? (જવાબમાં ઘણું જોશો) પૂર્વે ઋષિયો મુનિયોને ઘણા હરાવી કોહ-કંદ્રાઓમાં નસાડી મુકતાં, ત્યાં પણ તેઓને શુખે યજ્ઞ યાજ્ઞાદિ કરવા નહોતા દેતા, તેમાં તેમોએ આ નવું શું કર્યું છે? રાજ્ય તમારૂં નથી એટલી ખામી રહી છે.

દુલદુલ ઘોડાની લાદ ઉઠાવવાનું કોઈ ભાગ્ય શાળિના નસિબમાં નિર્માયુ હશે. શ્રી નિષ્કંલકીનાં ઘોડાની લાદ ભકતો ઉપાડશે, 'ફુંટો ખરિયોમાં ખુંદાશે.' પછી રાડું પાડશો! માટે સવેલા ચેતો હજુએ અવશર છે, આવો લાદ ઉઠાવવા ભાગ્યશાળી બનો!

realpatidar.com

શીવજી કાનજીનું ગુરૂપણુ તમે પુરેપુરૂં કર્યું છે,

https://archive.org/details/bk076/page/n41/mode/1up

realpatidar.com

જગતમાં મુર્ખ બનાવરાવ્યો ! જગન્નાથ પંડિતની ગંગાલ્હેરી તેમની સ્ત્રી યાવની. ચમ્તકાર, સર્વે ખોટા, કહેવા મંડી પડયો, ધન્ય તમારી કુંપનીને, તેમને મોઢે સાચુ છેજ કયાં ? જંબુકની ઉનાઇ જેવું છે, સાજીએ બોલે ને માંદી મરતી હોય તેએ ઉંનાઈ તો દેજ ! સત્પંથ વેદ ધર્મ હોવાનો સેંકડો પ્રમાણો પ્રગટે થઈ ગયા છે. ચાહે વેદ-માનો ચાહે તમારો દુરાગ્રહ માનો ?

વેદનો અધિકાર કોને છે ? વેદ જ્ઞાતા બ્રાહ્મણ રાવણ શ્રી રામચંદ્ર ભગવાનનો શત્રુ ! જંગલી અભણ ભીલ, ભાવડા 'પશુ, વાંદરા તે શ્રી રામના ભકત ! કડવાજી ! વાટ ઉઠી તમારી વિદ્યાને, "ભણેલા કણબી કટમ બોળે" તે સત્ય કરી દેખાડયું 'ધણી ધારે તે કરે, ને દેખનારા દાઝી મરે.' હાશમી (કૃષ્ણકુળ) વંશ શીરોમણી શ્રી અલિ (હરી=વિષ્ણુ), શ્રી બી બી ફાત્મા (શક્તિ) શ્રીસદગોર નબી મહમ્દ (બ્રહ્મા), ના અશંવાળો વંશ તેજ બની ફાતમાહ (હરી વંશ) કહેવાય છે. તેનેજ પુજવા વેદજ્ઞા છે ભવિષ્ય માટે પણ પુરાણો એજ ગાય છે (ભવિષ્ય પૂરાણ ઉં૦ ખ૦ ક૦ ૩ અ૦ ૫ મં૦ ૨૨–૩૯ ન્યુહ રાજા (નુહ અ૦) ની વાત લખી તે વંશમાં મલેચ્છ ગુણી ધર્મી થાશે; એ મલેચ્છ ગુણીનાને આર્ય કહેલા છે, એ સર્વ વિષ્ણુ ભક્ત થાશે; આધિ ઘણા પ્રમાણો છે (જવાબમાં જોશે,)

realpatidar.com

(તારિખે ફિરસ્તા ' : મરાતે મખ્લુકાત, બશારતે

https://archive.org/details/bk076/page/n42/mode/1up

realpatidar.com

અહમદી' નાશોખ ત્વારિખાદી, માં શ્રી બુદ્ધાલને આર્ય વ્રતનાં રાજાએ દિકરી પરણાવી હતી, તેના પુત્રને ગાદી ભિશેક કર્યો! તેજ શ્રી બુધ્ધા અવતાર છે, તેનો વંશ મીશર ગયો આદિ પ્રમાણો છે, નર્મ ગદ્ય' ભા. ૨ 'ગારિત્ર ચંદ્રીકાદિમાં તુર્કસ્તાનેમાં ઈ૦ સ૦ પાંચમાં સૈકા સુધીનો બ્રાહ્મણ, ક્ષત્રિ આદિના ભેદોની કથા છે, ટો૦ કૃત ર૧૦ માં સંવત ૭૮૪ માં ગીહલોત કુલ તિલક બાપ્પા રાવલ ચીભાડના સિહાસન પર બેઠા, પછી ઈરાન ચાલ્યા ગયા હતા. [ઘણું જવાબમાં.]

'પીરણા ગામના નામથી ધર્મનું નામ જોડનારાની આંખે પડલ છે, જેથી 'સત્પંથ' કહેતાં સુંઝાય છે! ગામના નામે ધર્મ ચાલતા હોય તો? ડાકોર પંથ ગયાજી પંથ ગોકલ પંથ, મથુરા, દ્વારાકા, ગઢડા, ઊંઝા, ચિત્રોડ, અમદાવાદ, નડિયાદ, વડતાલ, ભરૂચ, સિનોરાદિ પંથો કેમ નામ લેવાતા નથી ઈર્ષાએ સત્ય સંતાડી ગાંડુ બોલે શું વળશે?

ગંગાનું સ્થાન કળયુગ બેસતાં બદલાઈ ગયું, સાભ્રમતી ગંગા ગવાઈ ગઈ. હવે તો જુનો મોહ મૂકો!!! જ્યાં નિષ્કલંક નાથનું સ્થાન ત્યાંજ ગંગા. ગુજરાતમાં શ્રીજીનું સ્થાન ભવિષ્ય વેતાઓએ શાસ્ત્રોમાં ગાયું છે. એવું સિદ્ધ થએલાને પણ શું નથી માનવું! સુરા તો ખરા પાકયા છો! ખરી બહાદુરી તો એમાજ છે, કે શાસ્ત્ર કહે એક તો તમારે બીજુંજ કહેવું! શાસ્ત્રોમાં ઠામ, ઠામ જે જે સમયે જરૂર જણાયું તે કહ્યું છે. તમારે તે સમયે કાળજી

realpatidar.com

https://archive.org/details/bk076/page/n43/mode/1up

realpatidar.com

રાખી મરજી માફક લખાવરાવવું હતું ? હવે માથું ફૂટે શું થાય ? હમે વેદ શાસ્ત્રની બધે સ્થળે વંદનાજ કરીએ છીએ, નિંદાનું કામ તમારૂં છે. કર્યાજ કરો.

કાશીસહ ગંગાજી પીરાણે પધારેલાની વાત ઇતિહાસોમાં ગાજી રહી છે, કેમ્બલ ગેજીટ, મિરાતે, અહમદી. ગુજરાત સુવર્ણ સંગ્રહાદિ વિના પણ ઘણે ઠેકાણે છે, 'જવાબમાં જોશો.' તમે પણ એકવાર કબુલ કરી હવે શંકાઓ ઉઠાવો છો, કાશીસહ ગંગા પીરાણામાં ન માયે એ તમારી શંકા અસ્થાને છે. ગંગા શ્રી શંકરની જટામાં યુગોના યુગો એવી ગુંચવાઇ કે નીકળવા માર્ગયે ન મળ્યો ! અગસ્ત ૠષિએ સાત સમુદ્રો પેટનાં ખુણામાં સંતાડી દીધા ! તો બાળ કૃષ્ણે મોઢામાં ત્રણે ભોવન ભરી લીધા ! તે કરતાં પીરાણું કાંઇક મોટું હશે, અસંભવિતને સત્તાવાનો સંભવિત ઘડીકવારમાં કરી લે છે, તે આસ્તિકો માને છે, નાસ્તિકો બળ બાંધે છે. (વિશેષ જવાબમાં જોશો.)

એકવાર તમો તમારૂં ધર્મને ધર્મ પુસ્તકો નક્કી ઠરાવી પછી સત્પંથના શિષ્યો સાથે મુકાબલો કરો ! શ્રી ઇમામશાહ બાવાએ એજ કર્યું છે, જે શ્રી રામ શ્રી કૃષ્ણાદિએ કર્યું હતું. તમો તે કરો જે રાવણાદિ કરી ગયા. સૃષ્ટિને રમાડનાર અખંડ, અનંત, મહાન, બાજીગર વખતો વખત રમાડી ગયો છે' ને રમાડશે, દાનવોને રમાડનાર યુગ યુગનો રમતિયાળ પુરૂષ રમ્યાજ કરે છે. દાનવોને એક દિશાએ લઇ જઇ ધર્મિઓને માર્ગ અપાવે.

realpatidar.com

https://archive.org/details/bk076/page/n44/mode/1up

realpatidar.com

છે. એ એની રમતનું કારણ છે. એજ હમારો મહાન ગુરૂ છે. એનું ચરણામૃત ગંગોદકથી ઉત્તમ છે એનાજ ચરણમાં અડસઠે તિર્થ વસે છે. ગુરૂ ગિતા વાંચો પછી મોઢું ખટાણું કરો ! ત્રણે લોકમાં જેની ગતી છે. તેવા અવતારી પુરૂષના બળની આંકણી શુદ્ર પુરૂષ કેમ કરી શકે ? દૈવિક વસ્તુઓ દૈવાધિન હોય છે. તેની ગતી પણ દૈવો જેવીજ હોય છે. ગંગા લહેરી આદિ ખોટું કહેનાર બિચારા નાસ્તિકો શું જાણે : "તમારી વિદ્યાજ ગટર જેવી છે, કે જેના શબ્દાર્થ કોશમાં 'વિચિત્ર' શબ્દનો અર્થ 'સુતરડી' 'સંડાશ' લખેલું છે." દૈવિક કાર્ય બુદ્ધિમાનોના અનુમાન માંએ ના આવે, તેને કે અણધારેલ સ્થાનને 'વિચિત્ર' કહે છે. ધન્ય તમારી વિદ્યા અને બુધ્ધિને, જેવી વિદ્યા, તેવો ધર્મ ! જેવો આહાર, તેવો ઓડકાર ! જેવી જાત તેવી ભાષા ! વિષ્ટાનો ભોગિ વિષ્ટા વિના બીજુ શું જુવે ? દૈવ ગતિનું અનુમાન નાસ્તિકો ન કરી શકે.

મહાસાગરના પરવાના વાળા ધર્મ શાસ્ત્રોના નાવ વાંચી ગયા ? એ હિંસાવાદના પુસ્તકો માનતા હોવ તો છરિયો, પાટલા લઈ કેડ કશી તૈયારી કરો ! ને જો તે પુસ્તક ન માનવા હોય, તો એ વિના બીજા માનવાના પુસ્તકોના નામ બતાવો ?

કબ્રસ્તાનોમાં મરદાનાં હાડકાં માટીમાં ત્રણ ચાર હાથ ઉંડે દટાઈ ગયેથી અડી અભડાવાનું રહેતું નથી. ગંગાજિમાં નાખેલા અસ્થી સ્નાનીને શરીરે વળગે ! પાણી

realpatidar.com

https://archive.org/details/bk076/page/n45/mode/1up

realpatidar.com

પીનારના પેટની કબર કરે ! દરેક રીતે અપવિત્રજ કરનાર બને છે. તેથી ગંગા કરતાં હજારઘણું કબ્રસ્તાન પવિત્ર છે. તે વિના પુણ્યશાળી પુરૂષોના ચરણ સ્પર્શથી તો ગમે તેવું સ્થળ પણ પવિત્ર તીર્થક્ષેત્ર બની જઈ હજારો પાપી પાવન કરે છે.

ઉત્તરહિંદ ભણી હિન્દુઓ સુવરાદિ જનાવરો ઝટકે મારી ખવાની તકરાર ચલાવી રહ્યા છે. કડવાજી ! એજ હિંદુત્વકે બીજુ ? એને માંસાહાર કહેશો કે ફ્લાહાર ? મોઢામાં આંગળી ઘાલી બોલાવ્યા છે, તો સાંભળો ! આ જરા જેવી વાતમાં ગભરાઈ લુગડા ઉતારી ન નાખજો ! ઉંધી ધમકીયો દીધે શું વળશે ! ન્યાયાસનના દ્વાર બ્રિટીશ સરકારના કબજાવામાં છે. કોઈથી બંધ કરી શકતા નથી. સત્પંથીયોને સુલેહ પ્રિય જાણી ભય રહીત અતી બોલી ગયા તો, હવે શેનાગભરાઈ ધમકીયો આપી બ્હીવરાવો છો ? નીરાંતે શાંભળો, ભેળું કરેલું ભોગવવું પડેજ.

આ લેખમાં બતાવેલા પુસ્તકો વાંચો, પછી ભાંગરો વાટો ! દશમાં અવતાર વિષયીક ભવિષ્ય વાણી કેવી સચોટ પ્રતક્ષ છે ? ખરા ખોટાની પરિક્ષા કરો, પછી બોલો. જોયા વિના બોલવું તે જુઠું છે ?

હમારા મંત્રોની ભાષા માટે ભવિષ્ય પુરાણાદિના પ્રબળ પુરવા છે. અથર્વવેદી અલ્લોપનિષદ ૧૨૦૦ વર્ષ પહેલાના લખેલ વેદમાં મોજુદ છે તે ભાષા જુઓ ! કલી સંતારણિય ઉપનિષદ સંવત ૧૬૭૩ માં સુનિગરા નગર,

realpatidar.com

https://archive.org/details/bk076/page/n46/mode/1up

realpatidar.com

અચલજી વિશ્વનાથે લખેલા જુઓ ! શાસ્ત્રો સાચા માનતા હોવતો માનો, કે ભાવિ પુરણ થઈ ગયું. હમારા, પૂજ્ય દાતાઓની ભાષા અને જ્ઞાતિનું પુરૂં પ્રમાણ મલી મયું છે, હમારા દયાલજીની ભાષા શ્રીજીના માનની ખાતર વેદે ગાઈ છે. તે મંત્રોમા ગાઈએ છીએ. તમને તે ભાષાની સુગ હોય તો તમારી વ્યાલી ભાષામા તેનો અર્થ કરી તેનો ખરા ખોટાપણાનો વિચાર કરો ? પછી બોલો ! સાચા ખોટાનો સરટીફીકેટ એમ ના અપાય ! આ તો ભોળિયાઓને ભડકાવવાની કળા રચી છે, ભાષાની મારા મારીમા ધર્મ કાં ખુવો છો ? સત્પંથી અદ્વિત ભાવનાનાં પ્રચારનેજ વેદ સેવા કહે છે. તમો ખાર, વ્હેર, દ્વેષ કોમીવાદના પ્રચારને વેદ સેવા કહો ! કહો ! કહો ! કડવાજી !

શ્રી સદ્ગોર ઈમામશાહ બાવાજી નિઝારિયોના તો શું ? પણ અખિલ બ્રહ્માંડના ધણી હતા, શ્રી રામચંદ્ર સાથે રાવણ વેઢવા નહિ તો હેત કરવા આવ્યો હતો ! વાલમિકી ભુલ્યા તે ભૂલ તમે શોધી કાઢી ! શ્રી કૃષ્ણની સાથે કંસનો વ્હેર નહિ પણ પ્રેમ હતો ? શું બોલો છો ? વ્યાસજી ખોટી ગપો હાંકી ગયા ? એમ તમારૂં કહેવું છે ? કડવાજી એમ જુઠું લખે વિદ્વાન કેમ બનાશે ? સાચું શિખવું હોય તો સત્પંથીને શરણે આવો ! ઘર ખોડીયો વેદ ને છત્રીસમુ પુરાણ ન ચલાવો !

realpatidar.com

શ્રી સદ્ગોર ઈમામશાહ વેદના ગાડાવાલા, વેદના દલાલ, આદ્ય નારાયણના આડતિયા, ભક્તોનાં ઓરતિયા,

https://archive.org/details/bk076/page/n47/mode/1up

realpatidar.com

જગતના ધણી હતા. નિઝારી એકલી શાખા ઉપર શું છાપો છે ? શ્રી પીર કબીરૂં દીન સાહેબે 'સર્વ સમર્થ શ્રી સદ્‌ગોર ઈમામશાહ સાહેબને' સત્પંથના માલિક છે, તેમ સ્પષ્ટ સમજાવી દીધું છે. ભ્રાતીએ ભુલેલા ભુલાવે પડી દિલ ચાહે તેમ કહો ! નિરાધાર વાત માનનારા મૂર્ખ વિના બીજી કઇ પદ્ધિ લઇ શકે છે. એકજ પુસ્તક માનનારાઓમાં પણ ઘણા ભેદો પડવાથી ઘણા ધર્મો ચલાવે છે. શાસ્ત્ર સમજવાને વિદ્યા બુદ્ધિ, જ્ઞાન, અનુભવ અને અટકળ જોઇએ છે. એકલી અટકળ ને અનુમાન કામ લાગતા નથી.

દઝાડક શબ્દની દાઝે ગાળો ભાંડી વાળ્યા ? પણ એજ પદ્ધિ તમારે યોગ્ય છે. આખી જ્ઞાતિના સંપ અને આનંદનો નાશ કરી, કોમીવાદે ચડી, કંકાષ ઘાલિ જ્ઞાતિ છીન્ન ભિન્ન કરવાના કાળા કાવત્રા કરે જાઓ છો ! છતાં દઝાડક શબ્દથી દઝાયા ! ! તે લાયકાતની ખાત્રી કરવી હોય, તો તમારો દરેક લેખ કોઇ શાન્તી પ્રિય દેશ દાઝવાળા નેતાને વંચાવી અભિપ્રાય માંગો ! તમને 'દઝાડક' વિના બીજું કદીએ કાંઇ નહિજ કહે.

સૈયદોને ને કાકાને ખાનગી મતભેદને લઈ વાંધો હતો. મતભેદ મટે વાંધો મટી ગયો. તેને નિંદકોએ મોટું રૂપ આપ્યું. કજીયે રાજી થનારા કલહે પિપાશુઓને દઝાડક વિના બીજું શું કહે : દઝાડક ન હોત તો નાણાં ખરચી વાતો વેચાતી કેમ લેતા ? કજીયા દલાલ તેમાં પેટ પોષણ માને છે, સંત્પંથી તેને વિષનું મુળ સમજે છે. કઇ

Most of the information is mentioned with the intention of discrediting the Great Shri Narayan Ramji Limbani & his team and to demean the good work done by them in uplifting ther fellow caste members.
Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk076/page/n48/mode/1up

realpatidar.com

કોર્ટમાં કાકાને મેં ન્યાયાસન સામે પ્રતિજ્ઞા કરી, ઘણા અપકૃત્યો કરનાર, સ્વાર્થિ, પૈસાનો ગેર ઉપયોગ કરનાર, વ્યભિચારી, અપ્રમાણિક, પારકી મિલ્કત ખાઈ જનારો અને બદ ચાલનો કહ્યો છે ? બતાવો ! જો શુદ્ધ વર્ણથી પેદા થયા હશો ? તો જરૂર કોર્ટના સહિ શિક્કાવાળી નકલ તે જબાનીની કે જવાબની લઈ પ્રગટ કરશો ? પણ વર્ણસંકર હશો જ ? તો આ તમારી ખોટી વાત સાબિત નહિ કરી શકો ! આવો ! આજ તમારી સાચ જુઠની પરિક્ષા છે. હમારે ને કાકા લક્ષમણનો ફક્ત આ એકજ મુકદમો ચાલ્યો છે. મે અમદાવાદના જો૦ સે૦ ક૦ સ૦ જડજ સાહેબની કોર્ટમાં દીવની મુકદમો નંબર ૬૫ સને ૧૯૦૦ એ વીના આજ સુધી બીજો કોઈ મુકદમો થયો નથી હમારા વણે વકીલ મરી ગયા છે કાકા લખમણનો વકીલ મી. હોસંગજી જીવે છે. આથીજ તમારૂં ધર્મ જુઠું છે એમ જણાઈ ગયું. એ વાત વેચાતી લેતાં ઠગાયા છો. કાં બાપ દેવા જુઠું સરીમાચું છે.

માટી એટલે ખાક, ખાકમાંથી ઉપજેલ ખાકી=માટીવાલો, માટીનો. સર્વ સૃષ્ટિ ખાકમાંથી થઈ છે. તે ખાકમાં જ મળી જશે. ખાકજ સર્વને પવિત્ર કરનારી એકજ વસ્તુ છે. ખાકવિના સર્વે અપવિત્ર છે. શ્રી જીનું (૧) નામ માટિના પિતા અબુતુરાબ છે, જેમ તેઓ શ્રીજી જે માટીના પિતા છે, તેજ માટીવાલો હું છું, તમને ખાક (માટી)ની સુગ હોય તો ખાકથી વેગળા જતા રહો ! માટીમાં મલનાર માટીના શરિરને ખાકી ના કહે તો શું કહે ? જુમ્માનો-

realpatidar.com

Most of the information is mentioned with the intention of discrediting the Great Shri Narayan Ramji Limbani & his team and to demean the good work done by them in uplifting ther fellow caste members.
Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk076/page/n49/mode/1up

realpatidar.com

તિયારના મનુષ્ય કે જીવ પણાના સંબંધે સગપણની સુગ અમને નથી, તમો પિતરાઈ કબુલ કરતાં કેમ અચકાઓ છો ! જુમ્માનાં પૂર્વજો અસલ હિન્દુ બ્રહ્માની સર્જેલ સૃષ્ટિના એક પિતાનો પરિવાર, તમારો દેશી, બહુ દૂધ ચોખા ભેળા ખાધા હશે ? એવા ઘણા કારણોએ તમારો ઢુંકડાનો પિતરાઈજ ગણાય.

કલ્પો ને યુગોથી શ્રી પરમાત્માના મહાન અંશ વખતો વખત જે જે કુળમાં લિલા કરી તે ચમત્કાર ઋષિ મુનિઓ વર્ણવ્યા, તે ન માનનારા નાસ્તિકોની સંખ્યાનો આંકડો નક્કી થઈ શકયો નથી. વાણીઓથી નાસ્તિકતા પરખાઈ જાય છે; વર્ણસંકરના ચેપમાં ફસાએલ કડવાજી ! શ્રી મચ્છાદિ છ અવતારની માતાઓ રૂષિ પત્નીઓ હતી, ને બાકી ચારની ક્ષત્રીયાણી, તેમ મલેચ્છાણી થઈ છે. તે ક્રમવાર એક પછી એક એકજ વંશમાં મળી જાય છે પુરાણાદિની કથાઓ વાંચો ! પછી અખિલ બ્રહ્માંડના પુજ્ય દશે અવતારને વર્ણસંકર કહેવા હિમ્મત કરો ! મચ્છાદિ દશે અવતારનો એકજ વર્ણ હતો અથર્વ વેદ. કાં, ૧૩ મં ૧૯–૨૧ તે ભેદ જાણવો હોય તો પુરાણો, ઇતિહાસાદિક પુસ્તકો ગુરૂ પાસે રાખી શોધો. તેમ કરતાંએ ના જડે તો સત્પંથીને શિષ્ય ભાવે વિનવો ? તો તે શિખવાડી દેશે. (ટૂંક નોંધ જોવી હોય તો સત્પંથી આજ્ઞાપત્ર જૂઓ) તે સર્વ ભેદ જવાબમાં જોશો. બ્રહ્માથી ઉપજેલ સૃષ્ટિની

realpatidar.com

https://archive.org/details/bk076/page/n50/mode/1up

realpatidar.com વર્ણ બ્રાહ્મણી હોય તેને બદલી વર્ણસંકર થઈ, કડવાં લખાવતાં સરમ ના આવી ? સાથી બ્રાહ્મણટલી કડવા થઈ ગયા ? તે જરૂર ખુલાસો લખશો ?'

હું શ્રી સદગોર ઈમામશાહ સાહેબાની વંશ (આલ) નો છું, તેમનો દાસ છું. તેઓની આજ્ઞાધિન રહી સેવા કરનાર છું તેમ કરવા હમ્મેશ ઉમંગી રહું તેવી આશાવાળો છું ? એઓ શ્રી પાસે અહોનિશ એટલુંજ યાચ્યાં કરૂં છું. સત્પંથ સનાતની સમુદ્ર હોવાથી તેનો છેહ શ્રીજી વિના બીજો કોઈ લઈ શકેજ નહિ. તેના સેવકો રંચમાત્ર જાણવા પામે છે તેવા જાણકારોની સેવા કરનારો છું. મારો ઢોંગ કે જે હોય તે સેવાનો છે, મિથ્યા વાદિયોને ન રૂચે તો તે ભલે મને નિંદે.

ધર્મ માનવું પોતાની બુદ્ધિની કૌશલ્યતા ઉપર છે. એકજ ગુરૂના શિષ્યોમાં અનેક ફાંટા પડેલા હોય છે. એકજ મેહેતા ના નિશાળિયામાં એક જેટલી મુદતમાં વિદ્વાન બની રહે છે, તેમાં બીજો તેટલી મુદતમાં બારાખડી પુરી નથી કર્તો. વેદાદિ શાસ્ત્ર ઉંધા નાખી ભવૈયાના ભક્તોજ નાગો નાચ કરે છે ? જે ભાટોનાં પુસ્તકો ઉપર મોહેલા છે. તે વેદ મુકી ભાંડ ભવૈયાનાં ચોપડાનો નાદ કરે છે, તેજ ભેંશાસુરી ભુંગળુ કહેવાય ! એજ વર્ણસંકરનો મહાન પડઘો છે. ભાટોને સત્પંથીઓએ તેઓના કુતર્કોને લીધે દુર કર્યા. પછી તેમણે શત્રુવટ પુર્ણ કરવા શું, શું, કૌ નહિ કર્યા હોય ? ઉત્તમ વર્ણને વ્હેમમાં ઉથલાવી ૯

realpatidar.com

https://archive.org/details/bk076/page/n51/mode/1up

1980 - Narayan Ramjino Pratidhwani (76)

realpatidar.com

પાડવા કોશીશ કેમ નહિ કરી હોય ? એ કાંઈ ઓછી માયા નહોતી, તે સેર્વ (સહ પ્રમાણ જવાબમાં જોશો.)

અઢીની સંખ્યા યાદ રાખી છે. ને અનંત કોડીનો આંકડો કેમ ખુંચે છે ? શાસ્ત્રો રાક્ષસોની ઓળખાણ મોઢે દુર્ગંધાદિથી કહે છે, તમો ભલે તેને તમારા દેવોની એંધાણી માની લો ?

અકળાઈ ના જાઓ ! સાચું કહો ? નખત્રાણાનાં વિવા વખતે જે ખુનો થયા, તે કોઇએ જાણી જોઇને કર્યા ? એમ તમારૂં કહેવું છે હમે તો સાંભળ્યું હતું કે અચાનક બંધુક પોતાની મેળે ફુટીને ખુન થાય ને, હમેં તે ઉપરથી લખ્યું હતું. એ વાત ખરી ન હોય તો વાત કઈ છે ? તે બતાવો ? કચ્છરાજની પોલીસને આટલા દિવસ થાપ દઇ ભોળવી ખુનીને સંતાડયો ! એ પણ એક ભયંકર ગુનોહ કર્યો છે, ખુનીને સંતાડી કાલે બીજા ગુનાહ કરવા હિમ્મતવાન બનાવ્યો છે. એ કુતર્કે રાજ્ય દ્રોહીયોમાં તમારા નામોનો વધારો થયો છે. બન્ને બાજુએ ધાપ દઈ, જૂઠું બોલી અવળ સવળ સમજાવી દીધું હતું પણ હવે પાપ છાપરે ચઢી પોકાર્યું છે. કબુલ કર્યું છે, તો બતાવી દો, કે બંદુક ફોડી ખુન કરનાર ફલાણો માણસ છે ? હમો પણ કચ્છ રાજ્યની પોલીસનું ખાસ ધ્યાન ખેંચીએ છીએ. કે મી ! નારયણ રામેજી પોતાના "પવિત્ર ધર્મના પ્રકાશ" વાળા લેખનાં પાને ૧૩–૧૪ માં તે ખુનના ગુન્હાની કબુલત

realpatidar.com

Most of the information is mentioned with the intention of discrediting the Great Shri Narayan Ramji Limbani & his team and to demean the good work done by them in uplifting ther fellow caste members. Page 50 of 52
Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

આપે છે.

જરૂર ખુની પકડા...

મારા સુનેરી સુખનો માન્ય ક

ધુર્તતાની જાળ ઓળખી તમોને ત્યાગી,

છે. એજ સત્યનો જય કહેવાય તે તમારે પણ

પડ્યા છે. થોડા દિવસ પછી પાળવા પણ પડશે

તમારો પત્ર કાંઈ મારા અંગત ઝેર

નહોતો, તેની સુચના પણ મેં

લખી. તેને અંગત ઝેર કો

ઉશ્કેરવા દોડે, તે નીચતા

કોઈથી અંગત દ્વેષ, ઝેર,

પણ લેવા ઇચ્છતો નથી, ધ

શ્રી સદ્ગોર લખાવે છે તે

દ્વેષા પુતળું અંગત ઝેર,

દાટી, ધમકી વિગેરેથી જુ

કરશો! બીજું શું કરી

અવતાર પાત્રનાં શત્રુઓને

તેથી હમને તમારી દયા

સત્પંથને શરણ આવે

શત્રુવટમાં પડયા છો,

નહી શકો? ત્રણે લોવ

મારા મીત્ર! મારૂં મ

realpatidar.com

realpatidar.com

। માફી માંગી, શ્રીજીને શરણે
...આ. જીવીતનો ભરૂસો ખોટો છે,
શ્રીજી દયાળુ છે. તુર્ત માફી આપી
શ્રી નિષ્કલંકી નાથ તમોને શુદ્ધ બુધ્ધી

...ું.

બોલો ! શ્રી નિષ્કલંકી નાથની જય

શાન્તી, શાન્તી

લી. શુભેચ્છક

। સાહેબ 'અહમદઅલી'
ટિત વાંચજો, તા. ૯–૯–૨૫
આવૃતી તા. ૩૦–૬–૩૯
ત્રીજી આવૃતિ સં ૨૦૦૬
ચોથી આવૃતિ ૨૦૩૬
તા: ૯–૨–૮૦

realpatidar.com